SHARANAM INFRAPROJECT AND TRADING LIMITED

Regd. Office: 303, Earth Arise, Nr. Y.M.C.A. Club,S. G. Road, Makarba, Vejalpur, Ahmedabad, 380051, Gujarat CIN: L45201GJ1992PLC093662, Contact No. 079-29707666,

Email id: sharanaminfraproject@gmail.com, Website: www.sharanaminfra.co.in

Date: 19/06/2023

To The General Manager-Listing Corporate Relationship Department, BSE Limited, Ground Floor, P.J. Towers, Dalal Street, Mumbai-400001

Dear Sir/Madam,

Subject: Intimation under Regulation 84(1) of the Securities and Exchange Board of India

(Issue of Capital and Disclosure Requirements) Regulations, 2018 ("SEBI ICDR Regulations") and Regulation 30 of the Securities and Exchange Board of India

(Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Ref: Sharanam Infraproject and Trading Limited (Security ID: SIPTL, Security Code:

539584)

This is to inform you that the Company has issued an advertisement under Regulation 84(1) of the SEBI ICDR Regulations, which includes, inter alia, details of the date of completion of dispatch of the abridged letter of offer and application form, details in relation to centers where shareholders or persons entitled to receive rights entitlement may obtain duplicate copies of applications forms and details in relation to applications on plain paper by shareholders (the "Advertisement").

The Advertisement has been issued by the Company on Friday, i.e. 16th June, 2023, in all editions of English national daily newspaper, "Financial Express", all editions of Hindi national daily newspaper, "Jansatta", and Ahmedabad edition of Gujarati newspaper, "Financial Express".

We hereby submit the Advertisement in 'pdf' format for dissemination on your website.

This is for your information as also for the information of your members and the public at large.

Thanking you,

Yours faithfully,

For, M/s Sharanam Infraproject and Trading Limited



Mr. Jigneshkumar Parshottambhai Ambalia Managing Director

DIN: 07784782

સોના-ચાંદીના વાયદાના ભાવોમાં સુધારો : ક્રૂડ તેલમાં નરમાઇ : પ્રથમ સત્ર સુધી કોમોડિટીમાં ર્ગા. ૭,૫૫૫ કરોડ અને ઓપ્શન્સમાં રૂા.૧૨,૫૩૨ કરોડનું ટર્નઓવર : બુલડેક્સમાં રૂા.૧૭ કરોડના કામકાજ

કોમોડિટી બ્યુરો

મુંબઇ, તા. ૧૬ ડેરિવેટિવ્ઝ વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ રૂ.૫૯,૪૯૫ના ભાવે પહોંચ્યો બોલાઈરહ્યો હતો. ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કુલ રૂ.૨૦,૧૦૫.૨૫ કરોડનું રૂ.૪૭,૯૮૪ અને ગોલ્ડ-પેટલ ૧૨,૩૯૧

ધાતુઓના હતો. વાયદાઓમાં સોના-ચાંદીમાં

દેશના અગ્રણી કોમોડિટી રૂ.૫૯,૫૩૭ અને નીચામાં રૂ.૩૩*૬* વધી રૂ.૭૨,૪૭૨ અને જૂન વાયદો રૂ.૧.૩૦ વધી એક્સચેન્જ રૂ.૫૯,૨૩૪ના મથાળે અથડાઈ, ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.૨૨૩.૫૫ બોલાઈ રહ્યો હતો. એમસીએક્સ પરવિવિધ કોમોડિટી પ્રથમ સત્ર સુધીમાં રૂ.૧૪૦ વધી રૂ.૩૨૨ વધી રૂ.૭૨,૪૫૩

બિનલોહ

વાયદાઓમાં એમસીએક્સ પર ધાતુઓના ૫૨,૧૪૦ સોદાઓમાં સુંઘીમાં ૩,૧૦,૮૫*૬* સોદાઓમાં કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૧૦૩ વધી વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.૧,૮૮૯.૦*૬* કરોડનો ધંધો સોદાઓમાં થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો ટર્નઓવર નોંધાયું હતું, જેમાં જૂન કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૧૦ રૂ.૧,૪૦૯.*૬*૯ કરોડના વેપાર સત્રની શરૂઆતમાં ૧ બેરલદીઠ કોમોડિટી વાયદાનાં કામકાજનો વધી રૂ.૫,૯૩૬ના ભાવે પહોંચ્યો થયા હતા. તાંબુ જૂન વાયદો રૂ.૫,૭૬૮ના ભાવે ખૂલી, દિવસ હિસ્સો રૂ.૭,૫૫૪.૯૮ કરોડનો હતો. સોનું-મિની જુલાઈ વાયદો રૂ.૭૩૬.૪૦ના ભાવે ખૂલી, દરમિયાન ઉપરમાં રૂ.૫,૭૯૯ અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. ૧૦ પ્રામદીઠ રૂ.૧૧૭ વધી રૂ.૧.૮૦ ઘટી રૂ.૭૩૩.૪૫ અને નીચામાં રૂ.૫,૭૨૪ ના ૧૨૫૩૨.૯૩ કરોડનો હતો. રૂ.૫૯,૩*૬૬*ના સ્તરે પહોંચ્યો જ્યારેએલ્યુમિનિયમજૂન કોન્ટ્રેક્ટ મથાળે અથડાઈ, પ્રથમ સત્ર રૂ.૧ વધી રૂ.૨૦૫.૫૫ તેમ જ સુધીમાં રૂ.૩૧ ઘટી રૂ.૫,૭૬૫ ચાંદીના વાયદાઓમાં ચાંદી સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.૦.૫૫ વધી બોલાયોહતો,જ્યારેક્રૂડતેલ-મિની એમસીએક્સ પર *૬*૪,૭૨૩ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.૧૮૫નાભાવ થયા હતા. જસત જૂન વાયદો રૂ.૩૦ ઘટી . રૂ.૪,૨૪૩.૬૭ ૧ કિલોદીઠ રૂ.૭૨,૩૨૩ના ભાવે જૂન કોન્ટ્રેક્ટ રૂ.૧.૩૫ વધી રૂ.૫,૭૬૫ બોલાઈ રહ્યો હતો. કરોડનાં કામકાજ થયાં હતાં. ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૨૨૪નાભાવ થયા હતા. મિની નેચરલ ગેસ જૂન વાયદો ૧ વાયદાઓમાં રૂ.૭૨,૫૮૦ અને નીચામાં વાયદાઓમાં એલ્યુમિનિયમ- એમએમબીટીયૂદીઠ રૂ.૨૦૯ના એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો રૂ.૭૨,૦૨૨ ના મથાળે અથડાઈ, મિની જૂન વાયદો ૧ કિલોદીઠ ભાવે ખૂલી, રૂ.૩.૩૦ વધી સત્રની શરૂઆતમાં ૧૦ ગ્રામદીઠ પ્રથમ સત્ર સુધીમાં રૂ.૩૭૪ વધી રૂ.૦.૮૫ વધી રૂ.૨૦૫.૬૫ રૂ.૨૧૨.૬૦ અને નેચરલ ગેસ-

રૂ.૫૯,૩૪૦ના ભાવે ખૂલી, રૂ.૭૨,૫૦૦નાસ્તરેબોલાઈરહ્યો સીસુ-મિનીજૂનકોન્ટ્રેક્ટરૂ.૦.૫૦ મિની જૂન વાયદો ૩.૩ વધી વાયદાઓમાં એમસીએક્સ ખાતે કિલો દીઠ રૂ.૧,૫૮૯ના ભાવે રૂ.૧,૫૮૯ ના મથાળે અથડાઈ, દિવસ દરમિયાન ઉપરમાં હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ વધી રૂ.૧૮૪.૮૫ જસત-મિની ૨૧૨.૭ બોલાઈ રહ્યો હતો. રૂ.૧૨.૫*૬* કરોડનાં કામકાજથયા ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં પ્રથમ સત્ર સુધીમાં રૂ.૩૯ વધી

કોમોડિટીઝના હતા. કપાસ એપ્રિલ વાયદો ૨૦ રૂ.૧,૫૮૯ અને નીચામાં રૂ.૧,૫૮૯થયો હતો.

📵 **թոե** Housing Finance Limited Ghar Ki Baat

પરિશિષ્ટ-૪–એ – સ્થાવર મિલકત(તો) સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(૬) ની જોગવાઇઓ સાથે વંચાત

સિક્ચોરીટાઇગ્રેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાબ્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ સ્થાવર મિલકતોના વેચાણ માટે ઈ–હરાજી વેચાણ નોટીસ

શાખા ઓફીસ : ગીજો માળ, પાર્ટ ૧, મેઘા લાઉસ, કોટક બેંક સામે, મીઠાખળી લીં ગાર્ડન રોડ, એલિસબિજ, અમદાવાદ, ગુજરાત-3૮૦૦૦ શાખા ઓફીસ : ૩૦૫-૩૦૮, ત્રીજો માળ, ટિરાનિયમ સ્કવેર, અડાજણ ચાર સ્ટતા, અડાજણ, સુરત, ગુજરાત-૩૯૫૦૦૯, શાખા ઓફીસ : ૩૩૧, ત્રીજો માળ, ટ્રિવીચા કોમ્પલેસ, નટુભાઇ સર્કલ, વડોદરા, ગુજરાત-૩૯૦૦૦૭

આથી ખાસ કરીને કોલમ નં. એ માં જણાવેલ દેવાદાર(રો) અને જામેનદાર(રો) અને જારેર જનાનો નોટીસ આપવામાં આવે છે કે નીચે કોલમ નં. ડીમાં જણાવેલ સ્થાવર મિલકત (તો) સિક્ચોર્ડ લેણદારને ગીરો/ચાર્જડ કરાયેલ છે જેનો પ્રત્યક્ષ/પુરોસ કબજો (અહીં કોલમ નં. સી મા જણાવ્યા મુજબ) મેસમેં પીએનબી હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ (પીએનબીએચએફએલ) / રિકચોર્ડ લેણદારના અધિકૃત અધિકારીએ લઇ લીધો છે, "જેનું જ્યાં છે, જે છે અને જેમ છે" ના ધોરણે નીચે જણાવેલ વિગતો મુજબ વેચાણ કરવામાં આવશે. આથી અહીં નીચે કોલમ નં. એ માં જણાવેલ દેવાદાર(રો)/ગીરવેદાર(રો)/ લાગતા વળગતા દેવાદારો/ગીરવેદાર(રો) (અતમાન પછી) કાનુની વારસદારો કાનુની પાલસદાર (રો), અને કોન્સ કેને કોન્સ કોન્

| લોન નંબર, દેવાદાર/ સહ–દેવાદાર/ જામીનદાર(રો)/ કાનુની વારસદાર (એ) | માંગણા રકમ અને તારીખ (બી) | (સી) પ્રકાર કબજાનો | ગીરો મિલકતની વિગત (કી) | (ઇ) (ઇ) | ઇએમડી (૧૦ ટકા આરપી) (એફ) | બિક જમા કરવાની છેલી તારીખ (જી) | બિડ વૃદ્ધિની સ્ક્રમ (એચ) | નિરિક્ષણની તારીખ અને સમય (આઇ) | હરાજીની તારીખ અને સમય (જે) | જાણમાં હોય તેવા બોજા / કોર્ટ કેસ જો કોઇ હોય તો (કે) |
|---|--|--------------------------|---|-------------------------------------|--------------------------------|---|-----------------------------------|---|---|---|
| HOU/AHM/0916/318533 શ્રી મનુભાઇ લસ્મણભાઇ ચૌધકી (દેવાદાર) અને શ્રીમતી દેવીકાબેન મનુભાઇ શોધરી (સ6-દેવાદાર) શાખા: અમદાવાદ | ૧૩-૦૯-૨૦૨૧ નાં રોજ રૂા. ૧૭,૧૫,૩૦૧.૧૯ /-(રૂપિયા સત્તર લાખ પંદર હજાર ત્રણસો એક અને ઓગણીસ પૈસા પુરા) | (ભૌત્તિક) | ળી–૨૪/૨૦૩, સ્વામીનારાચણ પાર્ક, શ્રી રામ કુટીર સામે, નરોડા, અમદાવાદ, અમદાવાદ, ગુજરાત, ભારત–૩૮૯૨૩૦ | ₹I. ٩૬,४٩,०००/– | રૂા. ૧,૬૪,૧૦૦/− | ૧૮.૦૭.૨૦૨૩ ૦૫:૦૦ પીએમ | રૂા. ૧૦,૦૦૦/- | ૧૧.૦૭.૨૦૨૩ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૪.૩૦ કલાકે | ૧૯.૦૭.૨૦૨૩ બપોરે ૧૨.૦૦ થી ૨.૩૦ કલાકે | નથી |
| HOU/RJKT/0719/730229 શ્રી જિજ્ઞેશ કાલિદાસ બરાઇ (દેવાદાર) અને શ્રીમતી તેજ્સ્વી જિજ્ઞેશ બરાઇ (સહ-દેવાદાર) શાખા: રાજકોટ | રદ્-૧૦-૨૦૨૧ નાં રોજ રૂા. ૧૭,૬૬,૭૮૭.૪૮ /-(રૂપિયા સત્તર લાખ ઓગણસીત્તેર હજાર સાતસો સીત્યાંશી અને અડ્તાલીસ પૈસા પુરા) | (ભૌત્તિક) | કલેટ નં. ડી ૧, પહેલો માળ, આકાર કોમ્પલેસ, રૈયા ટેલિફોન એક્સરેન્જ પાસે, આરએનએસબી હેડ ક્લાર્ટર સામે, ૧૫૦ ફુટ રોડ, રૈયા, રાજકોટ, ગુજરાત-3૬૦૦૦૫ | ₹I. ঀ ६, ६७,०००/− | રૂા. ૧,૬૬,૭૦૦/− | ૧૮.૦૭.૨૦૨૩ ૦૫:૦૦ પીએમ | રૂા. ૧૦,૦૦૦/– | ૧૧.૦૭.૨૦૨૩ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૪.૩૦ કલાકે | ૧૯.૦૭.૨૦૨૩ બપોરે ૧૨.૦૦ થી ૨.૩૦ કલાકે | નચી |
| NHL/SRT/0119/635045 રમેશભાઇ પ્રાગ્સુભાઇ પેથાણી (દેવાદાર) અને તેજલબેન રમેશભાઇ પેથાણી (સહ-દેવાદાર) શાખા: સુરત | ૦૮-૦૪-૨૦૨૧ નાં રોજ રૂા. ૧૭,૧૪,૩૩૩.૫૧ /-(રૂપિયા સત્તર લાખ ચૌદ હજાર ગ્રણસો તેગ્રીસ અને એકાવન પૈસા પુરા) | (ભૌત્તિક) | શોપ નં. ર૪૨, બીજો માળ, બ્લોક ૨૪૨, એટલાન્ટા મોલ, એટલાન્ટા મોલ સામે, તુલસી આકંક સામે, અભિષેક એપાર્ટમેન્ટ 3 યાગે, સુદામા ચોક, ટીપી સ્કીમ નં. ૨૪, બ્લોક નં. ૨૪૯ એફપી નં. ૧૧૦, ઓપી નં. ૧૧૦, સુરત, ગુજરાત, ભારત-૩૯૪૧૦૧ (અંદાજે ૨૧૦ ચો. ફુટ) | રૂા. ૧૫,૪૭,૦૦૦/– | રૂા. ૧,૫૪,૭૦૦/– | ૦૪.૦૭.૨૦૨૩ ૦૫:૦૦ પીએમ | ₹I. 40,000/- | ૨૭.૦૬.૨૦૨૩ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૪.૩૦ કલાકે | | નચી |
| HOU/VA/0617/396015 શ્રીમતી આશા હિનેશ શર્મા (દેવાદાર) અને શ્રી હિનેશ રામકિશોર શર્મા (સહ–દેવાદાર) શાખા: વડોદરા | ૧૭-૦૮-૨૦૨૦ નાં રોજ રૂા. ૧૫,૫૨,૬૦૧.૭૯ /-(રૂપિયા પંદર લાખ બાવન હજાર છસ્સો એક અને ઓગણએંશી પૈસા પૂરા) | (भौत्तिङ) | ક્લેટ નં. ઇ– ૪૦૧ ૪૦૨, ચોચો માળ, સત્યમ બિલ્ડીંગ, શિવમ પાર્ક, ભાડકોદરા બસ સ્ટેન્ડ પાછળ, રાગીની ટોકિંઝ પાસે, મોજે-ભાડકોદરા, અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત, ભારત- ૩૯૨૦૦૧ | ₹I. 9 8,3 २, 000/− | ₹I. 9,83,200/− | ૧૮.૦૭.૨૦૨૩ ૦૫:૦૦ પીએમ | રૂા. ૧૦,૦૦૦/– | ૧૧.૦૭.૨૦૨૩ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૪.૩૦ કલાકે | ૧૯.૦૭.૨૦૨૩ બપોરે ૧૨.૦૦ થી ૨.૩૦ કલાકે | નચી |

* તેના પરના ૧૮ ટકા દરે લાગુ ચડત વ્યાજ તેમજ ચુકવણી અને/અથવા વસુલાતની તારીખ સુધી લાગુ આકસ્મિક ખર્ચ, કોસ્ટ, ચાર્જ વગેરે સહીત** પીએનબી હાઉસિંગ કાચનાન્સ લીમીટેડના અધિકૃત અધિકારીની શ્રેષ્ઠ જાણકારી અને માહિતી હેઠળ ઉપર જ્યાવેલ સ્થાવર મિલકત/સિક્ચોર્ડ મિલકતો પર કોલમ નં. કે માં જ્યાવેલ સિવાય કોઇ બોજો/ દાવો નથી. આવા અન્ય બોજાઓ સફળ ખરીદાર/બીકરે ભરવાના/યુકવવાના રહેશે. ભાવી ખરીદાર(સે)/ બીકરોને જ્યાવેલ

૨. ભાવી ખરીદાર / બીડર અને રસ ધરાવતી વ્યક્તિઓએ સ્વતંત્ર રીતે પસાર કરાયેલ પ્રક્રિયાઓ/આદેશોની દલીલોનું નિરિક્ષણ કરી શકે છે, જો કોઇ હોય તો જે કોલમ નં. કે માં જણાવેલ છે, જેમાં પીએનબીએચએફએલ પાસે ઉપલબ્ધ ટાઇટલન દસ્તાવેજો તેમજ અન્ય વિગતોનો સમાવેશ થાય છે અને ટેન્ડર / બીડ અરજીઓ સુપરત કરતા પહેલા અથવા ઓક્રર કરતા પહેલા તમામ પાંસાઓથી તેમની જાતને માહિતગાર કરી શકે છે. બીડરોએ આ હરાજીની શરતો અને નિયમો તેમજ

3. નોંધ લેવી કે સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) નિચમો, ૨૦૦૨ ના નિચમ ૯ (૩) મુજબ, બીડર(૨) / ખરીદાર વેચાણ કિમંતની ૨૫ ટકા (અર્નેસ્ટ મની ઉપોઝીટ, જો કોઇ હોય તો, તેના સહીત) રકમ તેજ દિવસે અથવા તેના આગામી દિવરં ૧મા કરવા કાનુનન બંધાયેલ છે. વેશાણ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૯(૨) મુજબ સિક્ચોર્ડ લેણદારને વેચાણ કિંમતની ૨૫ ટકા રકમ મળ્યા પછી ફક્ત બીડર(રો) ની તરફેણમાં કરવામાં આવશે. વેચા કિંમતની બાકીની ૭૫ ટકા રકમ ખીદારે વેચાણની મંજૂરીનો પત્ર મળયાની તારીખથી ૧૫ દિવસની અંદર ખરીદારે જમા કરવાની રહેશે, જેમાં કસુરના કિસ્સામાં મિલકત / સિક્ચોર્ડ એસેટનું ફરી વેચાણ કરવામાં આવશે.

૪. મેસર્સ સી ૧ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ ઇ-હરાજી મારફત વેચાણ કરવામાં અધિકૃત અધિકારીને મદદ કરશે જે તેની કોર્પોરેટ ઓફિસ પ્લોટ નં. દૂ૮ ૩જો માળ, સેક્ટર ૪૪, ગૂરગાઁવ, હારિયાણા, ૧૨૨૦૦૩ ખાતે ધરાવેછે. વેબસાઇ. www.bankeauctions.com. મિલકતના નિરિસણને સંબંધિત કોઇપણ સલેય માટે અથવા બીડ દસ્તાવેજો મેળવવા માટે અને કોઇ અન્ય પુછપરછ અથવા રજીસ્ટ્રેશન માટે, તમે શ્રી સચિન ભોગાનોકર / શ્રી પૃથ્વીરાજ ચરણ અને

બાઇલ નં. ୧૨૮૬૬૦૫૧૬ / ૮૪૪૮૧૯૮૪૫૮, અધિકૃત અધિકારી/સિક્ચોર્ડ લેણદારના વ્યક્તિનો સંપર્ક કરવો અથવા www.pnbhousing.com ની જોઇ શકો છો સ્થળ : અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ તારીખ : ૧૬–૦૬–૨૦૨૩

સહી/– અધિકૃત અધિકારી, પીએનબી હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ

નાબફિડ રૂપિયા ૧૦ હજાર કરોડના પ્રથમ દેવા વેચાણ માટે ૪.૭ ગણી બિડ મેળવી

પીટીઆઇ

ફાયનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર કન્વર્ટિબલ મેઇડન દેવા ઇસ્યૂઅન્સમાં હતી.

રૂપિયા દસ હજાર કરોડ ફાયનાન્સિયલ ગણો છલકાઇ ગયો હતો, ઇસ્યૂઅન્સે જેનો બેઝ ઇસ્યૂ રૂપિયા માઇલસ્ટોન

Requirements) Regulations, 2018 ("SEBI (ICDR) Regulations").

ISSUE OPENED ON

WEDNESDAY, MAY 31, 2023

FACILITY IS OPERATIONAL FROM THE ISSUE OPENING DATE.

ALLOTMENT OF THE RIGHTS EQUITY SHARES IN DEMATERIALIZED FORM:

ISSUE ACTIVITIES ON ACCOUNT OF EXTENSION OF ISSUE CLOSING DATE.

depository account in which our equity shares are held by such investor on the record date.

to shareholders to exercise their rights in the rights issue.

ASBA*

LAST DATE FOR APPLICATION:

BEING THE ISSUE CLOSING DATE.

સિક્યુરિટીઝ

ઊભા કર્યા છે અને લગભગ ઇન્સ્ટિટ્યૂશન-નાબફિડ

This advertisement is for information purposes only and not for publication, distribution, or release directly or indirectly outside

India. This is not an announcement for the offer document. All capitalized terms used herein and not confined herein shall have

the meaning assigned to them in the Letter of Offer dated May 23, 2023 (the "Letter of Offer" or "LOF") filed with the Main Board of BSE Limited ("BSE") and the Securities and Exchange Board of India ("SEBI") for information and dissemination on the

SEBI's website pursuant to the proviso to Regulation 3 of the Securities Exchange Board of India (Issue of Capital and Disclosure

SHARANAM INFRAPROJECT AND TRADING LIMITED

Corporate Identification Number: L45201GJ1992PLC093662

Regd. Office: 303, Earth Arise, Nr. Y.M.C.A. Club, S. G. Road, Makarba, Vejalpur, Ahmedabad - 380051, Gujarat

Email id: sharanaminfraproject@gmail.com, Website: www.sharanaminfra.co.in Telephone no. 079 2970 7666

Contact Person: Mr. Jinesh Deepakkumar Mistry, Company Secretary and Compliance Officer

Our Company was originally incorporated with the name and style Skyhigh Projects Limited under the Companies Act 1956 on 5th day of February, 1992 having Corporate Identification Number L45201PB1992PLC012001. Thereafter the name of the

Company had been changed from Skyhigh Projects Limited to Sharanam Infraproject and Trading Limited with effect 29th day of

July, 2015 and received a fresh Certificate of Incorporation from the Registrar of Companies, Chandigarh dated July 29, 2015.

The equity shares of our Company were listed on Main Board of BSE Limited on January 21, 2016. The Scrip symbol 'SIPTL' and

The company is a professionally managed company and functions through their Board of Directors. The Company doesn't NOTICE TO THE ELIGIBLE EQUITY SHARE HOLDERS OF SHARANAM INFRAPROJECT AND TRADING LIMITED -CORRIGENDUM CUM ADDENDUM TO LETTER OF OFFER DATED MAY 23, 2023 RIGHT ISSUE EXTENDED: REVISED ACTIVITY SCHEDULE

ISSUE PROGRAMME

ISSUE OF 75001500 EQUITY SHARES WITH A FACE VALUE OF ₹1 EACH ("RIGHTS EQUITY SHARES") OF OUR COMPANY FOR CASH AT A PRICE OF ₹ 1 EACH AT A PAR ("ISSUE PRICE") FOR AN AGGREGATE AMOUNT ₹ 750.02 LACS ON A RIGHTS

BASIS TO THE ELIGIBLE EQUITY SHAREHOLDERS OF OUR COMPANY IN THE RATIO OF 3 RIGHTS EQUITY SHARES FOR EVERY

2 FULLY PAID-UP EQUITY SHARES HELD BY THE ELIGIBLE EQUITY SHAREHOLDERS ON THE RECORD DATE, THAT IS ON MAY

22, 2023 (THE "ISSUE"). THE ISSUE PRICE FOR THE RIGHTS EQUITY SHARES IS 1 TIME THE FACE VALUE OF THE EQUITY

In accordance with Regulation 76 of the SEBI (ICDR) Regulations, SEBI Circulars no. SEBI/CFD/DIL/ASBA/1/2009/30/12 dated

December 30, 2009, CIR/CFD/DIL/1/2011 dated April 29, 2011 and SEBI/HO/CFD/DIL2/CIR/P/2020/13 dated January 22, 2020 ("SEBI ASBA Circulars"), all Investors desiring to make an Application in this Issue are mandatorily required to use the

ASBA process. Investors should carefully read the provisions applicable to such Applications before making their Application

PLEASE NOTE THAT RESIDENT INVESTORS CAN SUBMIT THEIR APPLICATION USING THE ASBA PROCESS ONLY. ASBA

This is to inform the eligible shareholders of the company that the date of closure of the rights issue, which opened on

Wednesday, May 31, 2023 scheduled to close on Friday, June 9, 2023 which was earlier extended by the company from Friday,

June 9, 2023 to Tuesday, June 20, 2023, vide the board resolution dated Friday, June 2, 2023, in order to provide an opportunity

FURTHER, THIS IS TO INFORM THE ELIGIBLE SHAREHOLDERS OF THE COMPANY THAT THE DATE OF CLOSURE OF THE

RIGHTS ISSUE, WHICH WAS EARLIER EXTENDED BY THE COMPANY FROM FRIDAY, JUNE 9, 2023 TO TUESDAY, JUNE 20,

2023, HAS BEEN FURTHER EXTENDED TO THURSDAY, JUNE 29, 2023 VIDE THE BOARD RESOLUTION DATED FRIDAY, JUNE

16. 2023. IN ORDER TO PROVIDE AN OPPORTUNITY TO SHAREHOLDERS TO EXERCISE THEIR RIGHTS IN THE RIGHTS

 $Please note that on the Issue\ Closing\ Date,\ Applications\ through\ ASBA\ process\ will\ be\ uploaded\ until 5.00\ p.m.\ (Indian\ Standard\ Loss)$

Please note that the rights equity shares applied for in this issue can be allotted only in dematerialized form and to the same

ELIGIBLE SHAREHOLDERS OF THE COMPANY WHO ARE ENTITLED TO APPLY FOR THE RIGHTS ISSUE ARE REQUESTED TO

TAKE NOTE OF THE ISSUE CLOSURE I.E. THURSDAY, JUNE 29, 2023. ACCORDINGLY, THERE IS NO CHANGE IN LETTER OF

OFFER, ABRIDGED LETTER OF OFFER, STATUTORY ADVERTISEMENT, ENTITLEMENT LETTER, AND APPLICATION FORM EXCEPT THE MODIFICATION IN THE ISSUE CLOSING DATE, RESULTNANT CHANGE IN INDICATIVE TIME TABLE OF POST

Time) or such extended time as permitted by the Stock Exchange or such extended time as permitted by the Stock Exchange. ACCORDINGLY, THE LAST DATE OF SUBMISSION OF DULY FILLED IN APPLICATION FORM IS THURSDAY, JUNE 29, 2023,

Simple, Safe, Smart way of Application- Make use of it!!!

*Application Supported by Blocked Amount (ASBA) is a better way of applying to issues by simply blocking the fund in the bank account, investors can avail the same.

For further details check section on ASBA below.

SHARES. FOR FURTHER DETAILS, SEE "TERMS OF THE ISSUE" ON PAGE 93 OF THE LETTER OF OFFER.

through ASBA. For details "Process of making an Application in this Issue" on page 94 of Letter of Offer.

ISIN 'INE104S01022'. The Corporate Identification Number of our Company is L45201GJ1992PLC093662.

પાંચ હજાર કરોડનો હતો, છે. નાબફ્રિડના મેનેજિંગ વિતરણ કરી દીઘું છે. તેમ ઇસ્યૂઅરે જણાવ્યું ડાયરેક્ટર રાજકિરણ રાય ધી નેશનલ બેંક ફોર હતું. અનસિક્યુર્ડ નોન- જીએ જણાવ્યું હતું કે કંપની બોન્ડસ બીએસઇ અને ડેટ દેવાના પ્રથમ જાહેર ઇસ્યૂને એનએસઇ પર લિસ્ટેડ ૭.૪૩ મળેલા ડેવલપમેન્ટ(નાબફિડ) એ ટકાના વાર્ષિક કૂપન દરથી ઉત્સાહિત બની છે અને ઇસ્યૂની મુખ્ય સલાહકાર છે જણાવ્યું હતું કે તેણે તેના રૂ ૧૦ વર્ષના સમયગાળા ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસમાં અને ક્રિસિલ અમરચંદ પિયા દસ હજાર કરોડના માટે ઇસ્યૂ કરવામાં આવી સતત સહભાગી બનવા મંગલદાસ ઓલ-ઇન્ડિયા માટે પ્રયત્નો વધારી રહી સલાહકાર છે. છે. કેન્દ્રે અત્યાર સુધીમાં રૂ પિયા ૨૦ હજાર કરોડની પાંચ ગણી બિડસ મેળવી દ્વારા આ સૌથી મોટું દેવા મૂડીનું રોકાણ કર્યુ છે અને હતી. જાહેર બોન્ડસને ઇસ્યૂઅન્સ છે તેમ જણાવી રૂપિયા પાંચ હજાર કરોડની રોકાણકરો તરફથી રૂપિયા એવો દાવો કરવામાં ગ્રાન્ટ પૂરી પાડી છે, તેમ ૨૩,૬૨૯.૫૦ કરોડનો આવ્યો છે કે નાણાકીય કંપનીએ જણાવ્યું હતું. ભારે પ્રતિભાવ મળ્યો સંસ્થાઓ દ્વારા બોન્ડ બેંકે તેની એક વર્ષની હતો, જે લગભગ ૪.૭ ઇસ્યૂઅન્સીઝ માટે આ કામગીરીમાં અંદાજે રૂ નવો પિયા ૧૫ હજાર કરોડની સજ્ર્યો ઇન્ક્રા લોનોનું ક્યારનુંયે

સપોર્ટથી થશે. એસબીઆઇ કેપ્સ આ

www.kotak.com કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ

રઝ. ઓફિસ : ચ્રું બીકેસી, સી-ચ્યું, જી બ્લીક, બાંબ્રા-કુર્લા કોમ્પલેક્ષ, બાંબ્રા (પૂ), મુંબઇ-પ૧. **કોર્પોરેટ ઓફિસ** : કોટક ઇન્ફીનિટી, બિલ્કીંગ નં. ૨૧, ઈન્ફીનિટી પાર્ક, જનરલ એ. કે. વૈધ માર્ગ, મલાક (પૂ), મુંબઇ-૯્ય

—— **જાહેર હરાજી** નીચે જણાવેલ ઉદ્યાસ્કર્તાએ નીચે જણાવેલ વિવરણ અનુસાર સોનાના દાગીનાની સામે સોનાની લોન સુવિધા મેળવી

હતી. ઉધારકર્તા આ લોનના હપ્તાની બાકી રકમ અને બાકી લ્હેણાંની ચૂકવણીમાં નિષ્ફળ ગયેલ છે. આથી બેંક દ્વારા આ બાકી લ્हેણાંની વસૂલાત માટે ઉધારકર્તાને નોટીસ કરેલ હતી. તેમ છતાં પણ ઉધારકર્તા બાકી લ્हેણાંની ચૂકવણી કરવામ અસફળ રહ્યા તેથી બેંક તેના નિકળતા બાકી લ્હેણાંની રકમની વસૂલાત માટે બેંક પાસે ઉધારકર્તાએ ગીરવે રાખેલ

| એપીએસી | નંબર નંબર | ઉદ્યારકર્તાનું નામ | રાજ્ય | ક્શળ | શાખા | ગ્રાસ વજન ગ્રામ માં |
|--|---|---|--|--|---|--|
| २४२७७०८ | | કેતન કાંતીલાલ કાપટેલ | ગુજ. | બરોડા | આણંદ | २३.१० |
| રપ૯૪૨૪૫ | 1८४५०५ | મમતાબેન રાવળ | ગુજ. | બરોડા | આણંદ | ૧૫.૯૨ |
| २२३८०५५ | 181203 | પિયુષ મંદાણી | ગુજ. | બરોડા | આણંદ | २४.3 ४ |
| २२१३५४४ | 132620 | અરમાન શેખ | ગુજ. | બરોડા | અંકલેશ્વર | 86.68 |
| ૨૫७૫૮૪૯ | 1८२५०० | મિસ્ત્રી અશરફ મોહંમદ શમીમ | ગુજ. | બરોડા | અંકલેશ્વર | 11.20 |
| €3800€3 | ૧૫૪૧૯૧ | પ્રજાપતિ મથંક ભાઈ | ગુજ. | બરોડા | અંકલેશ્વર | २४.८४ |
| २४७१३४૯ | 100002 | પંકજ મનજીભાઈ જવીચા | ગુજ. | રાજકોટ | ભક્તિનગર | ४८.२४ |
| २ 3१५03८ | ૧૫૧૦૯૯ | રમેશભાઈલખમણભાઈગામરા | ગુજ. | રાજકોટ | ભક્તિનગર | ૧૨.૬૫ |
| ૨૫૮૪૯૦૯ | 123438 | ઓડ મહેશભાઈ છડુભાઈ | ગુજ. | બરોડા | ભરૂચ કેસી | ૨૪.૨૪ |
| 1062026 | ८७५०१ | દિલીપસિંહ રામસિંહ સુનાવા | ગુજ. | બરોડા | ભરૂચ કેસી | 122.50 |
| २२१४२७३ | 136001 | નાનજીભાઈજયરામભાઈપ્રજાપતિ | ગુજ. | બરોડા | ભરૂચ કેસી | ¥3.9¥ |
| ૧७૬૨૧७૫ | ८ ४१00 | પરમાર કુસુમબેન મનહરભાઈ | ગુજ. | બરોડા | ભરૂચ કેસી | 65.65 |
| २०५३५५३ | 121000 | શાહબાઝ યુનુસ પટેલ | ગુજ. | બરોડા | ભરૂચ કેસી | ૨૫.૦૮ |
| २४४૯७८१ | 150883 | તન્વીર યુસુફ મુસા એકલા | ગુજ. | બરોડા | ભરૂચ કેસી | ४१.७५ |
| 1028182 | ७८८४५ | યુનુસ ઈસ્માઈલ ગેન્ડી | ગુજ. | બરોડા | ભરૂચ કેસી | 130.40 |
| ₹30∠03∠ | ૧૫૦૨૯७ | જદવાણી તુષાર દિપકભાઈ | ગુજ. | રાજકોટ | ભાવનગર | 15.12 |
| ૨૫૦૩૩૫૦ | १७३६४३ | સંજય ધીરૂભાઈ મકવાણા | ગુજ. | રાજકોટ | ભાવનગર | 11.50 |
| ₹33 9₹८0 | 143506 | સૈયદ ગુલામમુસ્તફા યુસુફશા | ગુજ. | રાજકોટ | ભુજ૧ | 30.90 |
| २३४७१४८ | ૧૫૪૯७૮ | સૈયદ ગુલામમુસ્તફા યુસુફશા | ગુજ. | રાજકોટ | ભુજ૧ | ૧૫.૪૦ |
| રપક૧૦૪૧ | 1८0७3८ | જ્યોત્સના વિજયકુમાર શાહ | ગુજ. | બરોડા | બીપીસી રોડ | 122.28 |
| 2830635 | 192203 | માલુસરે સાગર | ગુજ. | બરોડા | બીપીસી રોડ | 30.89 |
| २२२७८८१ | 180553 | પ્રદીપકુમાર જે. ચાદવ | ગુજ. | બરોડા | બીપીસી રોક | 180.00 |
| २२८८८६३ | 982096 | પ્રદીપકુમાર જે. ચાદવ | ગુજ. | બરોડા | બીપીસી રોક | ₹6.39 |
| 4874800 | 101366 | કેવલરામાણી તેજુ | ગુજ. | રાજકોટ | ગાંધીધામ | २૯.०४ |
| રરર૧૫૨૦ | 136612 | બોરાણીયા પ્રતીકભાઈ | ગુજ. | અમદાવાદ | ગાંધીનગર | ۷.58 |
| 2383356 | ૧૫૪૪૩૨ | વાઘેલા દિલીપભાઈ | ગુજ. | અમદાવાદ | ગાંધીનગર | ૧૯.૪૨ |
| ૨૧ ७૪૫૮૯ | 138313 | ઓમપ્રકાશ કાલઘર ઉપાધ્યાય | ગુજ. | સુરત | GIDC વાપી | 90.29 |
| २४८७९८७ | ૧७૩૨૨૬ | ડાંગોદરા કુંવરબેન કાળુભાઈ | ગુજ. | સુરત | હિરાબાગ | ७.९० |
| ૨૫૨૯૩૦૯ | ૧७૬૯૬૨ | હુમ્મર સાગર પરેશભાઈ | ગુજ. | સુરત | હિરાબાગ | ४७.30 |
| ૨૫૮૦૮૦૯ | 923000 | માણેક સુલ્તાન આમદભાઈ | ગુજ. | રાજકોટ | જામનગર | ٩८.४٥ |
| 1558430 | 033 23 | મચુર કરશનભાઈ બૈદીયાવદ્રા | ગુજ. | રાજકોટ | જામનગર | २२.७० |
| 1631803 | 20029 | વ્રજપાલસિંહ સી. ઝાલા | ગુજ. | રાજકોટ | જામનગર | 30.00 |
| ૨૦૯७૦૫७ | ૧૨૫૧૦૪ | ગાંધી શિલ્પાબેન | ગુજ. | અમદાવાદ | મણિનગર | 936.90 |
| २१७४९३२ | ૧૩૪૩૫૨ | પટેલ કેથુરભાઈ ભીખાભાઈ | ગુજ. | અમદાવાદ | મહેસાણા | G8.20 |
| १७ ૫१०૯४ | | પટેલ પંકજકુમાર બચુભાઈ | | અમદાવાદ | મહેસાણા | 802.28 |
| | ८२५१० | 1 1001 13 03 110 1130110 | ગુજ. | OPPLICATE | 16411611 | |
| २००१५८२ | 2२ ६१० ११२८८५ | જગદીશભાઈ દેવાભાઈ ઉઘરેજા | ગુજ. ગુજ. | રાજકોટ | મહસાહા | રરપ.રર |
| | | | - | | | |
| २००१५८२ | ૧૧૨૮૮૫ | જગદીશભાઈ રેવાભાઈ ઉઘરેજા | ગુજ. | રાજકોટ | મોરબી | રરપ.રર |
| २००१ ५८२ २३७७५७ ५ | 112224 142528 | જગદીશભાઈ રેવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીયા ઉમેશ | ગુજ. ગુજ. | રાજકોટ રાજકોટ | મોરબી મોરબી | ૨૨૫.૨૨ ૧૯.૪૬ |
| २००१४८२ २३७७४७ <i>६</i> २४१२ ८ ४१ | 112624 146528 153043 | જગદીશભાઈ રેવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીચા ઉમેશ | ગુજ. ગુજ. ગુજ. | રાજકોટ રાજકોટ બરોડા | મોરબી મોરબી નિઝામપુરા | २२५.२२ १૯.४ ९ १८.00 |
| २००१४८२ २३७७४७ <i>५</i> २४१२ ८ ४१ २१४७ ८ १७ | 112224 142528 153043 131121 | જગદીશભાઈ રેવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીયા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંડે | ગુજ. ગુજ. ગુજ. ગુજ. | બરોડા અરોડા રાજકોટ | મોરબી મોરબી નિઝામપુરા નિઝામપુરા | २२५.२२ १૯.४ ۶ १८.00 ८०.४८ |
| 20014/2 2300405 2812681 2180610 22142/6 | 998224 942588 953043 939929 136034 982362 | જગદીશભાઈ રૈવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીચા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંડે મિતેષ પ્રિથવદન ભાટીચા | ગુજ. ગુજ. ગુજ. ગુજ. ગુજ. | રાજકોટ બરોડા બરોડા બરોડા | મોરબી મોરબી નિઝામપુરા નિઝામપુરા નિઝામપુરા | २२५.२२ १८.४५ १८.०० ८०.४८ ३५.६० |
| 20014/2 2300405 2812681 2180610 22142/6 2261/06 | 998224 942588 953043 939929 136034 982362 | જગદીશભાઈ રૈવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીચા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંડે મિતેષ પ્રિથવદન ભાટીચા પટેલ પંકજભાઈ ભગવાનદાસ પટેલ પંકજભાઈ ભગવાનદાસ | ગુજ. ગુજ. ગુજ. ગુજ. ગુજ. ગુજ. | રાજકોટ બરોડા બરોડા બરોડા બરોડા બરોડા | મોરબી મોરબી નિઝામપુરા નિઝામપુરા નિઝામપુરા નિઝામપુરા | २२५.२२ १८.४५ १८.०० ८०.४८ ३५.६० ११.५४ |
| 20094/2 2306405 2812681 2980690 22142/6 2269/206 233389/2 | 998224 942588 953043 939929 936034 982302 943805 954388 | જગદીશભાઈ રેવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીચા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંડે મિતેષ પ્રિથવદન ભાટીચા પટેલ પંકજભાઈ ભગવાનદાસ પટેલ પંકજભાઈ ભગવાનદાસ | ગુજ. ગુજ. ગુજ. ગુજ. ગુજ. ગુજ. | રાજકોટ રાજકોટ બરોડા બરોડા બરોડા બરોડા બરોડા | મોરબી મોરબી નિઝામપુરા નિઝામપુરા નિઝામપુરા નિઝામપુરા નિઝામપુરા | 224.22 46.85 42.00 20.82 34.60 41.48 48.05 |
| 2001422 2300405 2812681 2180640 2214226 2261206 2333812 2831325 | 998224 942588 953043 939929 936034 982302 943805 954388 | જગદીશભાઈ રેવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીચા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંડે મિતેષ પ્રિચવદન ભાટીચા પટેલ પંકજભાઈ ભગવાનદાસ પટેલ પંકજભાઈ ભગવાનદાસ ઉકાણી રવિભાઈ પ્રવિણભાઈ દર્ષદ ભરતભાઈ રામાણી | 98. 98. 98. 98. 98. 98. 98. | રાજકોટ રાજકોટ બરોડા બરોડા બરોડા બરોડા બરોડા બરોડા | મોરબી મોરબી નિઝામપુરા નિઝામપુરા નિઝામપુરા નિઝામપુરા નિઝામપુરા નિઝામપુરા | 224.22 96.85 92.00 20.82 34.60 11.48 18.05 113.25 |
| 2001428 2300405 2812681 2180640 2214266 2261206 2333812 2831325 2321810 | 112224 142528 153043 131124 136034 142302 143205 154388 146024 182200 | જગદીશભાઈ રેવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીચા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંડે મિતેષ પ્રિચયદન ભાટીચા પટેલ પંકજભાઈ ભગવાનદાસ પટેલ પંકજભાઈ ભગવાનદાસ ઉકાણી રવિભાઈ પ્રવિણભાઈ હર્ષદ ભરતભાઈ રામાણી | 98. 98. 98. 98. 98. 98. 98. 98. | રાજકોટ રાજકોટ બરોડા બરોડા બરોડા બરોડા બરોડા બરોડા | મોરબી મોરબી નિઝામપુરા નિઝામપુરા નિઝામપુરા નિઝામપુરા નિઝામપુરા નિઝામપુરા નિઝામપુરા રસકોર્સ | 224.22 96.89 92.00 20.82 34.60 91.48 98.05 913.29 51.40 |
| 200142 2300405 241264 211426 2261206 2333412 2431325 2321410 224161 | 998224 983043 939929 982362 982362 98388 984388 986024 988890 98888 | જગદીશભાઈ રેવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીચા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંકે મિતેષ પ્રિચવદન ભાટીચા પટેલ પંકજભાઈ ભગવાનદાસ પટેલ પંકજભાઈ ભગવાનદાસ ઉકાણી રવિભાઈ પ્રવિણભાઈ દર્ષદ ભરતભાઈ રામાણી પીસાવડીચા અજય વદભભાઈ | 98. 98. 98. 98. 98. 98. 98. 98. 98. | રાજકોટ રાજકોટ બરોડા બરોડા બરોડા બરોડા બરોડા બરોડા રાજકોટ રાજકોટ | મોરબી મોરબી નિઝામપુરા નિઝામપુરા નિઝામપુરા નિઝામપુરા નિઝામપુરા નિઝામપુરા રસકોર્સ રસકોર્સ | 224.22 16.89 12.00 20.82 34.60 11.48 18.09 113.29 51.40 30.88 |
| 20014/2 23/6/4/6/4 21/4/6/4 21/4/6/6 22/14/6 23/33/1/ 23/3/1/6/1 23/0/6/2 | 998224 983043 939929 982362 982362 98388 984388 986024 988890 98888 | જગદીશભાઈ રેવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીચા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંકે મિતેષ પ્રિચયદન ભાટીચા પટેલ પંકજભાઈ ભગવાનદાસ પટેલ પંકજભાઈ ભગવાનદાસ ઉકાણી રવિભાઈ પ્રવિણભાઈ દર્ષદ ભરતભાઈ રામાણી પીસાવડીચા અજય વદભભાઈ રાજેશકુમાર બાબુલાલ પ્રજાપતિ વિનતા મિત્તલ | 9,8. 9,8. 9,8. 9,8. 9,8. 9,8. 9,8. 9,8. | રાજકોટ રાજકોટ બરોડા બરોડા બરોડા બરોડા બરોડા રાજકોટ રાજકોટ રાજકોટ | મોરબી મોરબી બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા રસકોર્સ રેસકોર્સ રેસકોર્સ | 224.22 96.85 96.86 34.60 11.48 18.05 13.65 51.40 30.88 96.15 |
| 20014/2 2300405 2412641 22142/6 22142/6 23331/ 23313/5 2321410 221161 2320022 2321/02 | 112/24 14/528 153043 1311/1 136034 18/38/6 143285 154388 146024 18220 146025 14616 1352/6 | જગદીશભાઈ રેવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીચા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંડે મિતેષ પ્રિચવદન ભાટીચા પટેલ પંકજભાઈ ભગવાનદાસ પટેલ પંકજભાઈ ભગવાનદાસ ઉકાણી રવિભાઈ પ્રવિણભાઈ હર્ષદ ભરતભાઈ રામાણી પીસાવડીચા અજચ વદાભભાઈ રાજેશકુમાર બાબુલાલ પ્રજાપતિ વનિતા મિત્તલ | 98. 98. 98. 98. 98. 98. 98. 98. 98. 98. | 리생회2 리생회2 여원5 여원5 여원5 여원5 여원5 여원5 여원5 건생회2 | મોરબી મોરબી બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા રસકોર્સ રેસકોર્સ સેટેલાઈટ | 224.22 16.85 12.00 20.82 34.60 11.48 18.05 113.25 51.40 30.88 12.15 |
| 20014/2 2300405 2812684 2110610 22142/6 2261/06 233381/ 28313/5 23/1810 281161 23/0022 23/1/08 2161160 | 112/24 14/528 153043 1311/1 136034 18/38/6 143285 154388 1460/4 18200 146025 14616 1352/6 12819 14819 | જગદીશભાઈ રેવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીચા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંડે મિતેષ પ્રિચવદન ભાટીચા પટેલ પંકજભાઈ ભગવાનદાસ પટેલ પંકજભાઈ ભગવાનદાસ ઉકાણી રવિભાઈ પ્રવિણભાઈ હર્ષદ ભરતભાઈ રામાણી પીસાવડીચા અજચ વદાભભાઈ રાજેશકુમાર બાબુલાલ પ્રજાપતિ વનિતા મિત્તલ | 9,8. 9,8. 9,8. 9,8. 9,8. 9,8. 9,8. 9,8. | રાજકોટ રાજકોટ બરોડા બરોડા બરોડા બરોડા બરોડા બરોડા બરોડા રાજકોટ રાજકોટ રાજકોટ સ્મદાવાદ અમદાવાદ | મોરબી મોરબી બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા રસકોર્સ રેસકોર્સ સેટેલાઈટ સેટેલાઈટ | 224.22 16.85 14.00 20.82 34.60 11.48 18.05 113.25 51.40 30.88 12.15 184.40 42.20 |
| 20014/2 2300405 2812664 2110610 221426 2261/06 233381/ 28313/5 23/1810 281161 23/0022 23/1/02 2161160 2460245 | 112224 142528 153043 131121 136034 142362 143265 154388 146024 182200 146025 146116 14 | જગદીશભાઈ રેવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીચા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંકે મિતેષ પ્રિથવદન ભાટીચા પટેલ પંકજભાઈ ભગવાનદાસ પટેલ પંકજભાઈ ભગવાનદાસ ઉકાણી રવિભાઈ પ્રવિણભાઈ હર્ષદ ભરતભાઈ રામાણી પીસાવકીચા અજચ વદાભભાઈ રાજેશકુમાર બાબુલાલ પ્રજાપતિ વનિતા મિત્તલ વિરાજા સુનિલ ગોવિંદભાઈ બાલાર સતીષભાઈ બાબુભાઈ | 98. 98. 98. 98. 98. 98. 98. 98. 98. 98. | રાજકોટ રાજકોટ બરોડા બરોડા બરોડા બરોડા બરોડા બરોડા બરોડા રાજકોટ રાજકોટ રાજકોટ અમદાવાદ અમદાવાદ | મોરબી મોરબી બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા રેસકોર્સ રેસકોર્સ સેટેલાઇટ વરાઇ! રોડ | 224.22 16.85 14.00 20.82 34.60 11.48 18.05 113.25 51.40 30.88 12.15 184.40 42.20 28.22 |
| 20014/2 2300405 2812664 2119610 22142/6 233381/ 28313/5 23/1810 281161 23/082 23/180 24160 2460245 2343/08 | 112224 142528 153043 131121 136034 142362 143265 154388 146024 182200 146025 146116 14 | જગદીશભાઈ રેવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીચા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંકે મિતેષ પ્રિચવદન ભાટીચા પટેલ પંકજભાઈ ભગવાનદાસ પટેલ પંકજભાઈ ભગવાનદાસ ઉકાણી રવિભાઈ પ્રવિણભાઈ દર્ષદ ભરતભાઈ રામાણી પીસાવડીચા અજચ વદાભભાઈ રાજેશકુમાર બાબુલાલ પ્રજાપતિ વનિતા મિત્તલ વિરાજા સુનિલ ગોવિંદભાઈ બાલાર સતીષભાઈ બાબુભાઈ ચિરાગ પી. મંદાણી | 98. 98. 98. 98. 98. 98. 98. 98. 98. 98. | રાજકોટ રાજકોટ બરોડા બરોડા બરોડા બરોડા બરોડા બરોડા બરોડા રાજકોટ રાજકોટ રાજકોટ અમદાવાદ અમદાવાદ સુરત | મોરબી મોરબી બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા રેસકોર્સ રેસકોર્સ સેટલાઇટ સેટલાઇટ વરાઇ! રોડ વરાઇ! રોડ | 224.22 16.85 14.00 20.82 34.60 11.48 18.05 113.25 51.40 30.88 12.15 184.40 42.20 28.22 29.88 |
| 20014/2 2300405 2812664 2119610 22142/6 233381/ 28313/5 23/1810 281161 23/082 23/180 24160 2460245 2313/08 21126/5 | 112224 142528 153043 131121 136034 142302 143205 154388 146024 146024 146025 146025 146025 146116 146025 146116 146025 146116 146025 14 | જગદીશભાઈ રેવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીચા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંકે મિતેષ પ્રિથવદન ભાટીચા પટેલ પંકજભાઈ ભગવાનદાસ પટેલ પંકજભાઈ ભગવાનદાસ ઉકાણી રવિભાઈ પ્રવિણભાઈ હર્પદ ભરતભાઈ રામાણી પીસાવડીચા અજચ વદાભભાઈ રાજેશકુમાર બાબુલાલ પ્રજાપતિ વનિતા મિત્તલ વિરાજા સુનિલ ગોવિંદભાઈ બાલાર સતીષભાઈ બાબુભાઈ ચિરાગ પી. મંદાણી | 23%. 23%. 23%. 23%. 23%. 23%. 23%. 23%. | રાજકોટ રાજકોટ બરોડા બરોડા બરોડા બરોડા બરોડા બરોડા બરોડા રાજકોટ રાજકોટ સાજકોટ અમદાવાદ અમદાવાદ સુરત સુરત | મોરબી મોરબી બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા રસકોર્સ રેસકોર્સ સેટલાઇટ યરાછા રોડ વરાછા રોડ વરાણા રોડ | 224.22 16.85 14.00 20.82 34.60 11.48 18.05 113.25 51.40 30.88 12.15 184.40 42.20 28.22 28.88 88 |
| 20014/2 2300405 2812664 2110610 2211266 233381/2 233181/2 233181/2 2341810 221161 2340022 2460205 2460205 23134007 211266/5 21268/5 | 112224 142528 153043 131121 136034 142302 143205 154388 146024 146024 146025 146025 146025 146116 146025 146116 146025 146116 146025 14 | જગદીશભાઈ રેવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીચા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંકે મિતેષ પ્રિથવદન ભાટીચા પટેલ પંકજભાઈ ભગવાનદાસ પટેલ પંકજભાઈ ભગવાનદાસ ઉકાણી રવિભાઈ પ્રવિણભાઈ હર્પદ ભરતભાઈ રામાણી પીસાવડીચા અજચ વદાભભાઈ રાજેશકુમાર બાબુલાલ પ્રજાપતિ વિરાજા સુનિલ ગોવિંદભાઈ બાલાર સતીષભાઈ બાબુભાઈ ચિરાગ પી. મંદાણી દિરજભાઈ છગનભાઈ અકબરી દિનેશભાઈ લરૂમણભાઈ કલાશીચા | 98. 98. 98. 98. 98. 98. 98. 98. 98. 98. | રાજકોટ રાજકોટ બરોડા બરોડા બરોડા બરોડા બરોડા બરોડા બરોડા રાજકોટ રાજકોટ સ્વજકોટ અમદાવાદ અમદાવાદ સુરત સુરત | મોરબી મોરબી બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા રસકોર્સ રેસકોર્સ સેટેલાઇટ યરાછા રોડ વરાઇ રોડ વરાઇ રોડ વરાઇ રોડ | 224.22 16.85 14.00 20.82 34.60 11.48 18.05 113.25 51.40 30.88 12.15 184.40 42.20 28.22 29.88 88.30 |
| 20014/2 2300405 2812664 2119610 221426 2333816 2333816 2341810 221110 22 | 112/24 14/528 15/30/3 1311/2 136/34 14/30/2 14/30/2 14/30/2 14/30/2 14/30/2 14/30/2 14/30/2 14/30/2 14/30/3 15 | જગદીશભાઈ રેવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીચા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંકે મિતેષ પ્રિથવદન ભાટીચા પટેલ પંકજભાઈ ભગવાનદાસ પટેલ પંકજભાઈ ભગવાનદાસ ઉકાણી રવિભાઈ પ્રવિણભાઈ હર્પદ ભરતભાઈ રામાણી પીસાવડીચા અજચ વદાભભાઈ રાજેશકુમાર બાબુલાલ પ્રજાપતિ વિના મિત્તલ વિરાજા સુનિલ ગોવિંદભાઈ બાલાર સતીષભાઈ બાબુભાઈ ચિરાગ પી. મંદાણી દિરજભાઈ છગનભાઈ અકબરી દિનેશભાઈ લસ્મણભાઈ કલાથીથા જીતેન્દ્રપ્રતાપ કે. સિંઘ | 98. 98. 98. 98. 98. 98. 98. 98. 98. 98. | રાજકોટ રાજકોટ બરોડા બરોડા બરોડા બરોડા બરોડા બરોડા રાજકોટ રાજકોટ સ્વજકોટ અમદાવાદ અમદાવાદ સુરત સુરત સુરત | મોરબી મોરબી ભેઝામપુરા ભેઝામપુરા ભેઝામપુરા ભેઝામપુરા ભેઝામપુરા રેસકોર્સ રેસકોર્સ સેટલાઇટ યરાછા રોડ વરાછા રોડ વરાછા રોડ વરાછા રોડ | 224.22 16.85 14.00 20.82 34.60 11.48 18.05 113.25 51.40 30.88 12.15 1844.40 42.20 28.22 29.88 88.30 48.62 |
| 20014/2 2306405 24142/6 22142/6 233341/ 24313/5 23/1410 244161 23/0022 2461160 2460245 24126/2 | 112224 142528 153043 131121 136034 182365 154388 146024 18200 146025 14616 135226 144082 126003 158020 142085 22628 166022 | જગદીશભાઈ રૈવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીયા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંઠે મિતેષ પ્રિયવદન ભાટીયા પટેલ પંકજભાઈ ભગવાનદાસ પટેલ પંકજભાઈ ભગવાનદાસ ઉંકાણી રવિભાઈ પ્રભિણ ઇંદ ભરતભાઈ રામાણી પીસાવડીયા અજય વદાભભાઈ રાજેશકુમાર બાબુલાલ પ્રજાપતિ વનિતા મિત્તલ વિરાજા સુનિલ ગોવિંદભાઈ બાલાર સતીયભાઈ બાબુભાઈ ચિરાગ પી. મંદાણી ચિરજભાઈ છગનભાઈ અકબરી દેનેશભાઈ લસ્મણભાઈ કલાથીયા જીતેન્દ્રપ્રતાપ કે. સિંઘ કાનજીભાઈ એમ. ભીંગારડીયા | 94. 94. 94. 94. 94. 94. 94. 94. 94. 94. | રાજકોટ રાજકોટ બરોડા બરોડા બરોડા બરોડા બરોડા બરોડા રાજકોટ રાજકોટ સ્વજકોટ અમદાવાદ અમદાવાદ સુરત સુરત સુરત સુરત | મોરબી મોરબી ભેઝામપુરા ભેઝામપુરા ભેઝામપુરા ભેઝામપુરા સ્ત્રેકોર્સ રેસકોર્સ સેટલાઇટ યરાછા રોડ વરાઇ રોડ વરાઇ રોડ વરાઇ રોડ વરાઇ રોડ | 224.22 16.85 14.00 20.82 34.60 11.48 18.05 113.25 51.40 30.88 12.15 184.40 42.20 28.22 29.88 48.50 12.62 100.20 |
| 20014/2 2306405 24142/6 22142/6 233341/ 24313/5 23/1410 244160 2460245 2412/6 2460245 2412/6 | 112224 142528 153043 131121 136034 182365 154388 146024 18200 146025 14616 135226 128100 14808 1 | જગદીશભાઈ રૈવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીયા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંડે મિતેષ પ્રિયવદન ભાટીયા પટેલ પંકજભાઈ ભગવાનદાસ પટેલ પંકજભાઈ ભગવાનદાસ ઉંકાણી રવિભાઈ પ્રભાણ દર્ષદ ભરતભાઈ રામાણી પીસાવડીયા અજય વદાભભાઈ રાજેશકુમાર બાબુલાલ પ્રજાપતિ વભિતા મિત્તલ વિરાજા સુનિલ ગોવિંદભાઈ બાલાર સતીષભાઈ બાબુભાઈ ચિરાગ પી. મંદાણી ચિરાજા પી. મંદાણી ચિરજભાઈ છગનભાઈ અકબરી દેનેશભાઈ લસ્ત્રપણભાઈ કલાથીયા જીતેન્દ્રપ્રતાપ કે. સિંઘ કાનજીભાઈ એમ. ભીંગારડીયા પંકજકુમાર | 94. 94. 94. 94. 94. 94. 94. 94. 94. 94. | राषकीट राषकीट जरोडा जरोडा जरोडा जरोडा जरोडा राषकीट राषकीट राषकीट राषकीट समहापाद स्मुरत सुरत सुरत सुरत सुरत | મોરબી મોરબી બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા રેસકોર્સ રેસકોર્સ સેટલાઈટ વરાછા રોડ વરાછા રોડ વરાછા રોડ વરાછા રોડ વરાછા રોડ વરાછા રોડ વરાછા રોડ | 224.22 16.85 14.00 20.82 34.60 11.48 18.05 113.25 51.40 30.88 12.15 184.40 42.20 28.22 29.88 48.50 23.30 42.62 100.20 10.05 |
| 20014/2 2306405 24142/6 22142/6 233341/ 24313/5 23/1410 244160 2460245 2341/60 2460245 2341/60 2460245 2341/60 2460245 24126/60 2460245 24126/60 2460245 24126/60 2460245 24126/60 2460245 24126/60 2460245 24126/60 2460245 24126/60 2460245 24126/60 2460245 24126/60 2460245 24126/60 2460245 24126/60 2460245 24126/60 241 | 112224 142528 153043 131121 136034 182365 154388 146024 18200 146029 146029 146116 135226 128100 148089 22628 148089 22628 148082 148082 148082 148082 148082 148082 148082 148082 148082 148082 148082 148082 148082 148082 | જગદીશભાઈ રૈવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીયા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંડે મિતેષ પ્રિયવદન ભાટીયા પટેલ પંકજભાઈ ભગવાનદાસ પટેલ પંકજભાઈ ભગવાનદાસ ઉકાણી રવિભાઈ પ્રભિણ ઈર્ષદ ભરતભાઈ રામાણી પીસાવડીયા અજય વદાભભાઈ રાજેશકુમાર બાબુલાલ પ્રજાપતિ વિભા મિત્તલ વિભા મિત્તલ બાલાર સતીયભાઈ બાબુભાઈ ચિરાગ પી. મંદાણી ચિરજભાઈ છગનભાઈ અકબરી દિનેશભાઈ લસ્ત્રપણભાઈ કલાથીયા જીતેન્દ્રપ્રતાપ કે. સિંઘ કાનજીભાઈ એમ. ભીંગારડીયા પંકજકુમાર | 94. 94. 94. 94. 94. 94. 94. 94. 94. 94. | રાજકોટ રાજકોટ બરોડા બરોડા બરોડા બરોડા બરોડા બરોડા રાજકોટ રાજકોટ રાજકોટ અમદાવાદ અમદાવાદ સુરત સુરત સુરત સુરત સુરત સુરત સુરત | મોરબી મોરબી બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા રસકોર્સ રેસકોર્સ સેટલાઇટ વરાછા રોડ વરાછા રોડ વરાછા રોડ વરાછા રોડ વરાછા રોડ વરાછા રોડ વરાછા રોડ વરાછા રોડ વરાછા રોડ | 224.22 16.75 12.00 20.72 34.60 11.47 17.05 13.25 51.40 30.77 12.15 174.40 42.20 27.22 27.77 174.20 1 |
| 20014/2 2306405 2812664 211664 221166 233381/2 281313/5 23/1100 221161 23/0202 23/0202 21126/5 23/0202 21126/5 23/0203 2100021 2130303 2169352 2849536 2346540 | 112224 142528 153043 131121 136034 182365 131388 146024 182000 146029 146029 128196 12 | જગદીશભાઈ રેવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીયા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંડે મિતેષ પ્રિયવદન ભાટીયા પટેલ પંકજભાઈ ભગવાનદાસ પટેલ પંકજભાઈ ભગવાનદાસ ઉકાણી રવિભાઈ પ્રભાણ દર્ષદ ભરતભાઈ રામાણી પીસાવડીયા અજય વદાભભાઈ રાજેશકુમાર બાબુલાલ પ્રજાપતિ વગિલા મિત્તલ વિરાજા સુનિલ ગોવિંદભાઈ ભાલાર સતીષભાઈ બાબુભાઈ ચિરાગ પી. મંદાણી ચિરજભાઈ છગનભાઈ અકબરી દિનેશભાઈ લસ્પ્રભાઈ કલાથીયા જીતેન્દ્રપ્રતાપ કે. સિંઘ કાનજીભાઈ એમ. ભીંગારડીયા પંકજકુમાર પ્રવિણાઈએલ. ગોયાણી સીરોયા રાઘવેન્દ્ર જી. | 94. 94. 94. 94. 94. 94. 94. 94. 94. 94. | રાજકોટ રાજકોટ બરોડા બરોડા બરોડા બરોડા બરોડા બરોડા રાજકોટ રાજકોટ રાજકોટ સમદાવાદ સરત સુરત સુરત સુરત સુરત સુરત સુરત સુરત | મોરબી મોરબી બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા રેસકોર્સ રેસકોર્સ સેટેલાઈટ વરાછા રોડ વરાછા રોડ | 224.22 16.75 14.00 20.72 34.60 11.47 17.05 13.25 51.40 30.77 12.15 174.40 42.20 27.22 27.77 17.20 17.2 |
| 20014/2 23364/26 24146/26 233381/2 2321810 2241161 232022 2321202 241202 | 112224 142528 153043 131121 136034 142305 143205 146024 142025 144042 124003 158020 142045 14 | જગદીશભાઈ રેવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીયા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંડે મિતેષ પ્રિયવદન ભાટીયા પટેલ પંકજભાઈ ભગવાનદાસ પટેલ પંકજભાઈ ભગવાનદાસ ઉકાણી રવિભાઈ પ્રભાઈ દર્ષદ ભરતભાઈ રામાણી પીસાવડીયા અજય વદાભભાઈ રાજેશકુમાર બાબુલાલ પ્રજાપતિ વિભા મિત્તલ વિભા મિત્તલ વિભા મુનેલ ગોવિંદભાઈ બાલાર સતીષભાઈ બાબુભાઈ ચિરાગ પી. મંદાણી ચિરજભાઈ છગનભાઈ અકબરી દેનેશભાઈ લસ્ત્રપણભાઈ કલાથીયા જીતેન્દ્રપ્રતાપ કે. સિંઘ કાનજીભાઈ એમ. ભીંગારડીયા પંકજકુમાર પ્રવિણાઈ એલ. ગોચાણી સીરોયા રાઘવેન્દ્ર જી. કોરી પિન્કીબેન | 94. 94. 94. 94. 94. 94. 94. 94. 94. 94. | રાજકોટ રાજકોટ બરોડા બરોડા બરોડા બરોડા બરોડા રાજકોટ રાજકોટ રાજકોટ સમદાવાદ સમદાવાદ સુરત સુરત સુરત સુરત સુરત સુરત સુરત સુરત | મોરબી મોરબી બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા રેસકોર્સ રેસકોર્સ સેટેલાઈટ વરાછા રોડ વરાછા રોડ | 224.22 16.75 14.00 20.72 34.60 11.47 17.05 13.25 51.40 30.77 12.15 174.40 42.40 27.22 27.77 174.60 10.09 52.02 175.12 26.27 26.27 26.27 |
| 20014/2 23364/3 2116/3 2116/3 22116/3 | 112224 142528 153043 131121 136034 142305 143205 146024 142025 144042 124003 158020 142045 14 | જગદીશભાઈ રેવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીયા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંડે મિતેષ પ્રિયવદન ભાટીયા પટેલ પંકજભાઈ ભગવાનદાસ પટેલ પંકજભાઈ ભગવાનદાસ ઉંકાણી રવિભાઈ પ્રભાઈ દર્ષદ ભરતભાઈ રામાણી પીસાવડીયા અજય વદાભભાઈ રાજેશકુમાર બાબુલાલ પ્રજાપતિ વભિતા મિત્તલ વિરાજા સુનિલ ગોવિંદભાઈ બાલાર સતીષભાઈ બાબુભાઈ ચિરાગ પી. મંદાણી ચિરાગ પી. મંદાણી ચિરજભાઈ છગનભાઈ અકબરી દેનેશભાઈ લસ્ત્રપણભાઈ કલાથીયા જીતેન્દ્રપ્રતાપ કે. સિંઘ કાનજીભાઈ એમ. ભીંગારડીયા પંકજકુમાર પ્રવિણાઈ એસ. ગોચાણી સીરોયા રાઘવેન્દ્ર જી. કોરી પિન્કીબેન પટેલ પ્રેમીલાબેન | 94. 94. 94. 94. 94. 94. 94. 94. 94. 94. | રાજકોટ રાજકોટ બરોડા બરોડા બરોડા બરોડા બરોડા રાજકોટ રાજકોટ રાજકોટ સમદાવાદ સમદાવાદ સુરત સુરત સુરત સુરત સુરત સુરત સુરત સુરત | મોરબી મોરબી બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા રેસકોર્સ રેસકોર્સ સેટેલાઈટ વરાછા રોડ વરાછા રોડ | 224.22 16.75 14.00 20.72 34.60 11.47 17.05 13.25 51.40 30.77 12.15 174.40 42.40 27.22 27.77 174.40 17.00 17. |
| 20014/2 2306405 2412640 2214266 233341/2 24313/5 23/1470 224161 23/022 24/161 23/022 24/162 2 | 112224 142528 153043 131121 136034 142305 143205 146024 142025 144042 124040 142043 14 | જગદીશભાઈ રેવાભાઈ ઉઘરેજા તરપરા મનસુખ પ્રભુલાલ બારીયા ઉમેશ મંદાકીની પ્રધુમન પાંડે મિતેષ પ્રિયવદન ભાટીયા પટેલ પંકજભાઈ ભગવાનદાસ પટેલ પંકજભાઈ ભગવાનદાસ ઉકાણી રવિભાઈ પ્રભાઈ દર્ષદ ભરતભાઈ રામાણી પીસાવડીયા અજય વદાભભાઈ રાજેશકુમાર બાબુલાલ પ્રજાપતિ વિભા મિત્તલ વિભા મિત્તલ વિભા મુનેલ ગોવિંદભાઈ બાલાર સતીષભાઈ બાબુભાઈ ચિરાગ પી. મંદાણી ચિરજભાઈ છગનભાઈ અકબરી દેનેશભાઈ લસ્ત્રપણભાઈ કલાથીયા જીતેન્દ્રપ્રતાપ કે. સિંઘ કાનજીભાઈ એમ. ભીંગારડીયા પંકજકુમાર પ્રવિણાઈ એલ. ગોચાણી સીરોયા રાઘવેન્દ્ર જી. કોરી પિન્કીબેન | 94. 94. 94. 94. 94. 94. 94. 94. 94. 94. | 지생하고 이 기생하고 이 기생 | મોરબી મોરબી બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા બિઝામપુરા રેસકોર્સ રેસકોર્સ સેટલાઇટ વરાછા રોડ વરાછા રોડ વરાઇ રોડ વર્ડ વર્ડ વર્ડ વર્ડ વર્ડ વર્ડ વર્ડ વર્ | 224.22 16.75 14.00 20.72 34.60 11.47 17.05 13.25 51.40 30.77 12.15 174.40 22.20 25.77 24.20 25.77 25.02 10.05 10.05 174.12 26.27 26.27 26.27 24.22 26.27 24.20 24.20 24.20 25.77 25.77 26.27 26.27 26.27 26.27 26.27 26.27 27.15 |

અધિકૃત અધિકારી, કોટક મહિન્દ્રા બેંક લિ.

CIN: L99999MH1984PLC032172 Registered Office : Sadoday Gyan (Ground Floor), Opp. NADT, Nelson Square, Nagpur - 440 013, Maharashtra, India.

Website: www.zimlab.in, e-mail: cs@zimlab.in Telephone No. Registered Office: 0712-2981960, Works Office: 07118-271990 NOTICE OF THE 39th ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

ZIM LABORATORIES LIMITED

Notice is hereby given that the 39th Annual General Meeting (AGM) of the Company will be held on Monday, 10th July, 2023 at 11:30 a.m. IST through Video Conferencing (VC)/ Other Audio Visual Means (OAVM) in compliance with the applicable circulars issued by the Ministry of Corporate Affairs (MCA) and Securities and Exchange Board of India (SEBI) The Notice setting out the Ordinary and Special Business(es) to be

sent through emails to the members whose email IDs were registered with the Company / Depository Participants. The email dissemination has beer The Notice of the AGM and the Annual Report are available on the website of the Company, i.e., www.zimlab.in under the Investors section, the websites of the Stock Exchanges, i.e., www.bseindia.com and

transacted during the AGM and the Annual Report for F.Y. 2022-23 has beer

www.nseindia.com; and on the website of NSDL, i.e. www.evoting.nsdl.com. In terms of the provisions of section 108 and other applicable provisions if any, of the Companies Act, 2013, read with the Companies (Management ind Administration) Rules, 2014, as amended, and Regulation 44 of th Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide to its Members the facility to exercise their right to vote on business as set forth in the Notice of the 39th AGM by electronic means through both remote e

electronic voting facility. Members holding shares as of the cut off date may cast their votes using an electronic voting system (remote e-voting). All members may please

voting and e-voting at the AGM. The Company has appointed the National Securities Depository Limited (NSDL) as the agency to provide ar

| Cut-Off Date | Monday, 03 rd July, 2023 |
|---------------------------------|-------------------------------------|
| Commencement of remote e-voting | Friday, 07 th July, 2023 |
| | (From 09:00 a.m. IST) |
| End of remote e-voting | Sunday, 09 th July, 2023 |
| | (Up to 5:00 p.m. IST) |

Remote e-voting will be disabled by NSDL upon the expiration of the

The facility for voting through the e-voting system will also be made available during the AGM. Members attending the AGM through the VC / OAVM facility who have not cast their votes by remote e-voting will be able to vote during the AGM.

Members who have cast their votes on the resolutions through remote evoting prior to the AGM will be eligible to attend the AGM but will not be eligible to cast their vote on such resolutions at the meeting again. Once the vote on the resolution is cast by a member, the member will not be allowed to change it subsequently or cast the vote again.

Only those members whose names are recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as of the cut-off date shall be entitled to avail themselves of the facility of remote e-voting or e-voting at the AGM. The voting rights of Members shall be in proportion to their share in the paid-up equity share capital of the Company as of the cut-off date.

Any person who becomes a member of the Company after the Company sends the Notice of the 39" AGM by email and holds shares as of the cut-off date, i.e., 03rd July, 2023 may obtain a User ID and password by sending a request to the Company's email address cs@zimlab.in. However, if a perso is already registered with NSDL for e-voting, then their existing user ID and password can be used for casting the vote.

The members of the Company holding shares in physical form and who have not registered their e-mail IDs are requested to provide a duly signed Form ISR-1 along with supporting documents to the Company's RTA - Link Intime India Pvt. Ltd., at their office at 247 Park, C-101 L.B.S. Marg, Vikhroli (West), Mumbai 400083, Tel: +91 22 49186270, or by email at rnt.helpdesk@linkintime.co.in. The said form is available on the website of the RTA at https://web.linkintime.co.in/KYC-downloads.html. Members holding shares in the demat form can update their e-mail address with their Depository Participant.

Ms. Roshni Jethani, Practising Company Secretary, has been appointed by the Board of Directors of the Company as the Scrutinizer for scrutinizing the remote e-voting process and voting at the AGM in a fair and transparen

The results of the remote e-voting and votes cast at the AGM shall be declared on or before 12th July, 2023. The Results declared, along with the Scrutinizer's Report, shall be placed on the Company's website www.zimlab.in and on the website of NSDL, i.e., www.evoting.nsdl.com mmediately after their declaration, and communicated to the Stock Exchanges where the Company is listed, viz., BSE Limited and NSE Limited.

Members who need technical assistance before or during the AGM of have queries regarding e-voting: • They may refer to the Frequently Asked Questions (FAQs) and the e-voting user manual available at the download section of www.evoting.nsdl.com

Date: 17.06.2023

Send a request to Mr. Amit Vishal, Senior Manager, or Ms. Pallavi Mhatre Manager, NSDL, at evoting@nsdl.co.in/022-48867000/022-24997000.

> By Order of the Board of Directors For ZIM LABORATORIES LIMITED (Piyush Nikhade) Company Secretary & Compliance Officer

Date: June 16, 2023

Mr. Jinesh Deepakkumar Mistry Company Secretary and Compliance Officer

For, Sharanam infraproject and trading limited

ISSUE CLOSES ON

THURSDAY, JUNE 29, 2023

શાખાઓ ખાતે તા. ૨૯.૦૬.૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે કે ત્યારબાદ યોજાશે. ઉપરોક્ત દરાજીમાં ભાગ લેવા ઇચ્છુક દરેક બોલીકારોએ ફોટો આઈડી પ્રુવ, સહી તેમજ સરનામાના પ્રમાણિત નકલો તેમજ ઓરીજનલ સાથે બે ફોટોગ્રાફ સહિતના દસ્તાવેજો દરાજીના દિવસે સાથે લાવવાના રહેશે. બેંક કોઈને પણ કોઈપણ જાતની સૂચના આપ્યા વગર હરાજીનું સ્થળ, તારીખ, સમય ને બદલવા અથવા રદ કરવાનો અબાધિત અધિકાર ધરાવે છે. જાહેર હરાજીના શરતો અને નિચમોની વધુ વિગતો માટે નીચે જણાવેલ અધિકૃત્ત અધિકારીનો સંપર્ક કરવા વિનંતિ. તારીખ : ૧૬.૦૬.૨૦૨૩

कर्मचारी मुआवजा अधिनियम का उद्देश्य सामाजिक न्याय देना : सुप्रीम कोर्ट

मृतक के परिवार को बढ़ा मुआवजा दिया जाए

जनसत्ता ब्यूरो नई दिल्ली 16 जून।

सुप्रीम कोर्ट ने कहा कि कर्मचारी मुआवजा अधिनियम 1923 का उद्देश्य सामाजिक न्याय प्रदान करना है। न्यायमुर्ति जेके माहेश्वरी और न्यायमूर्ति अरविंद कुमार की पीठ ने ममता देवी की अपील स्वीकार करते हुए मृत कर्मचारी के परिजनों को कर्मकार मुआवजा अधिनियम, 1923 के तहत बढ़ा हुआ मुआवजा देने का आदेश दिया है। पीठ ने इस मामले में एक सहानुभृतिपूर्ण दृष्टिकोण अपनाया और मामले को फिर से विचार के लिए वापस हाईकोर्ट भेजने के बजाय स्वयं मृतक के परिवार को बढ़ा हुआ मुआवजा देने का आदेश दिया।

पीठ ने ममता देवी और अन्य बनाम रिलायंस जनरल इंश्योरेंस कंपनी लिमिटेड

भोपाल, १६ जून (भाषा)।

'पाठ्यपुस्तकों में

संशोधन पर रुख

बताए उद्धव

महाराष्ट्र में भारतीय जनता

पार्टी (भाजपा) के वरिष्ठ नेताओं

ने कर्नाटक सरकार द्वारा स्कूली

पाठ्यपुस्तकों में किए गए संशोधन

को शुक्रवार को अल्पसंख्यक

तृष्टिकरण बताया और शिवसेना

(यूबीटी) प्रमुख उद्धव ठाकरे से

इस मामले पर अपना रुख स्पष्ट

नेतृत्व वाली कर्नाटक सरकार ने

गुरुवार को राष्ट्रीय स्वयंसेवक

संघ (आरएसएस) के संस्थापक

के बी हेडगेवार और हिंदुत्व

विचारक वीडी सावरकर से जुड़े

अध्यायों सहित कई अन्य

अध्यायों को हटाकर मौजूदा

शैक्षणिक वर्ष के लिए राज्य में

कक्षा छह से दसवीं तक की

कन्नड़ और सामाजिक विज्ञान की

पाठ्यपुस्तकों के पुनरीक्षण को

(यूबीटी), कांग्रेस और राष्ट्रवादी

कांग्रेस पार्टी (राकांपा)

महाविकास आघाड़ी गठबंधन का

हिस्सा हैं। भाजपा अक्सर अपने

पूर्व सहयोगी शिवसेना (यूबीटी)

पर हिंदुत्व की विचारधारा से दूर

होने का आरोप लगाती रही है।

महाराष्ट्र के उपमुख्यमंत्री देवेंद्र

फडणवीस ने पत्रकारों से कहा कि

दक्षिणी राज्य में कांग्रेस की सत्ता में

वापसी के बाद कर्नाटक में स्कूल

की पाठ्यपुस्तकों में संशोधन की

पहले से ही संभावना थी। उन्होंने

कहा, 'कांग्रेस सावरकर और

हेडगेवार को पाठ्यपुस्तकों से हटा

सकती है, लेकिन लोगों के दिल

और दिमाग से नहीं। महाराष्ट्र में

विपक्ष कर्नाटक माडल को

दोहराना चाहता है। मैं उद्धव

ठाकरे से पूछना चाहता हूं कि इस

मुद्दे पर उनका क्या रुख है।'

फडणवीस ने कहा, यह स्पष्ट है

कि ठाकरे ने सत्ता के लिए अपनी

विचारधारा से समझौता किया है।

सहयोगी और भाजपा के प्रदेश

अध्यक्ष चंद्रशेखर बावनकुले ने

कहा कि ठाकरे को पाठ्यपुस्तक

के मुद्दे के साथ-साथ पिछली

सरकार द्वारा लाए गए धर्मांतरण

विरोधी कानून को रद्द करने के

कर्नाटक सरकार के फैसले पर

अपना रुख स्पष्ट करना चाहिए।

नागपुर में फडणवीस के पार्टी

महाराष्ट्र में शिवसेना

मंजूरी दे दी है।

गौरतलब है कि कांग्रेस के

मुंबई, 16 जून (भाषा)।

करने के लिए कहा।

भाजपा ने कमलनाथ

के गढ़ छिंदवाड़ा में

जीत दर्ज की

मध्यप्रदेश में छिंदवाड़ा निर्वाचन क्षेत्र के अंतर्गत आने वाले एक वार्ड में हुए उपचुनाव में भारतीय जनता पार्टी (भाजपा) ने जीत दर्ज

राज्य चुनाव कार्यालय द्वारा घोषित परिणामों के अनुसार पार्षदों के पद के लिए कल 13 स्थानीय निकाय उपचनाव हए थे, जिनमें से सात

पर भाजपा ने और छह पर कांग्रेस ने जीत दर्ज की है। प्रदेश कांग्रेस

अध्यक्ष और पूर्व मुख्यमंत्री कमलनाथ के गढ़ माने जाने वाले छिंदवाड़ा नगर निगम के वार्ड संख्या 42 पर हुए उप चुनाव में भाजपा ने जीत दर्ज की है। छिंदवाड़ा नगर निगम के वार्ड सख्या 42 में भाजपा के संदीप सिंह चौहान ने कांग्रेस के राजेंद्र स्वामी को 436 वोटों से हराया। जीत से उत्साहित प्रदेश भाजपा अध्यक्ष विष्णु दत्त शर्मा ने इस जीत को सरकार द्वारा 'गरीबों के कल्याण' के लिए लागू की गई योजनाओं को समर्पित किया। उन्होंने कहा, ' कमलनाथ और उनके सांसद बेटे नकुल

नाथ दोनों ने उपचुनाव में अपनी पार्टी के उम्मीदवार के लिए प्रचार

किया। इसके बावजुद भाजपा वार्ड के सभी बुथों पर विजयी हुई और

इतिहास रचा।'अधिकारियों ने कहा कि उपचुनाव के लिए मतदान 13

जून को हुआ था, जबकि मतगणना शुक्रवार को हुई। गौरतलब है कि प्रदेश में अगले साल के अंत में विधानसभा चुनाव होने हैं।

की है। उपचुनाव के परिणाम शुक्रवार को घोषित किए गए।

वकील एक ट्रक चालक के रूप में कार्यरत थे व 2011 एक दुर्घटना में उनकी मृत्यु हो गई थी। डयूटी के दौरान मौत के मुआवजे का दावा चौधरी की पत्नी, पुत्र और माता-पिता ने किया।

और अन्य में फैसला सनाते हुए माना कि जब मृत कर्मचारी की पत्नी ने शपथ पर उसकी आय बताई है और नियोक्ता इसे स्वीकार करता है तो कल्पना की किसी भी सीमा तक उप श्रम आयुक्त न्यूनतम श्रम दर पर मुआवजे से कम मुआवजे का आदेश नहीं दे सकते थे। वकील चौधरी ट्रक चालक के रूप में कार्यरत थे व 21 अप्रैल 2011 को एक दुर्घटना का शिकार हो गए। जिसमें उनकी मृत्यु हो गई थी। डयूटी के दौरान मौत के मुआवजे का दावा चौधरी की पत्नी, पुत्र

और माता-पिता ने किया। जिन्होंने 'कर्मचारी मुआवजे के लिए उप श्रम आयुक्त-सह-आयुक्त' के समक्ष एक दावा याचिका दायर की थी। जिसमें रोजगार के दौरान हुई उनकी मृत्य के लिए मुआवजे की मांग की गई थी। तर्क था कि वकील चौधरी ट्रक चालक के रूप में हर महीने छह हजार रुपए का वेतन कमा रहे थे व वेतन की राशि नियोक्ता द्वारा स्वीकार की गई थी। आपत्तिजनक वाहन के बीमाकर्ता, रिलायंस जनरल इंश्योरेंस कंपनी लिमिटेड ने लिखित बयान दायर किया लेकिन नियोक्ता या बीमाकर्ता द्वारा मामले को आगे नहीं बढ़ाया गया। आय के किसी प्रमाण के अभाव में उप श्रम आयुक्त ने 150 रुपए प्रति दिन की न्यूनतम मजदूरी दर के अनुसार 3,900 रुपए प्रति माह मृतक की आमदनी मानी। तदनुसार, छह फीसद सालाना ब्याज के साथ 4,31,671 रुपए का

अवार्ड प्रदान किया गया। जो बीमाकर्ता द्वारा अपीलकर्ताओं को देय था पर अपीलकर्ताओं ने अवार्ड को हाईकोर्ट के समक्ष चुनौती दी। हाईकोर्ट ने अवार्ड को इस आधार पर रद कर दिया कि यह विवाद एक विवादित मामला था व यह कोरम-गैर-न्यायिक था। यह अभिनिर्धारित किया गया था कि अपीलकर्ताओं को न्यायिक श्रम न्यायालय के समक्ष शिकायत का पालन करना था। कामगार मुआवजा अधिनियम, 1923 की धारा 20(1) और 20(2) के मद्देनजर, सरकार ने एक अधिसचना जारी की थी। जिसके तहत श्रम न्यायालय के पीठासीन अधिकारियों को अधिनियम के तहत उत्पन्न होने वाले सभी विवादित दावों का न्यायनिर्णयन सौंपा गया था। अपीलकर्ताओं ने हाईकोर्ट के आदेश को हाईकोर्ट की ही खंडपीठ के समक्ष चुनौती दी।

कर्नाटक के सभी मंत्री 21 को दिल्ली तलब

बंगलुरु, 16 जून (भाषा)।

कर्नाटक के उपमुख्यमंत्री डीके शिवकुमार ने शुक्रवार को कहा कि कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे ने राज्य के सभी मंत्रियों को आगामी 21 जून को दिल्ली बुलाया है।

कर्नाटक सरकार के मंत्री दिल्ली प्रवास के दौरान केंद्र सरकार के अलग अलग मंत्रियों से मलाकात कर प्रदेश से जड़ी परियोजनाओं के बारे में बात कर सकते हैं। शिवकुमार ने इससे इनकार नहीं किया कि मुख्यमंत्री सिद्धरमैया और वह प्रधानमंत्री नरेंद्र मोदी से मुलाकात कर सकते हैं। यह पूछे जाने पर कि दिल्ली प्रवास के दौरान मुख्यमंत्री सिद्धरमैया प्रधानमंत्री मोदी से मुलाकात करेंगे तो शिवकुमार ने कोई सीधा जवाब नहीं दिया और सिर्फ यह कहा, 'हम सभी संघीय ढांचे में हैं। हम सबको मिलकर काम करना है।'

कर्नाटक प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष ने कहा, '21 जून को हमारी पार्टी के अध्यक्ष ने हम सभी मंत्रियों को दिल्ली बुलाया है क्योंकि हममें से कुछ ने राहुल गांधी और खरगे से मलाकात नहीं की है।

कायालय नगर पालिक नगम, खण्डवा

क्रमांक- ६६८/जन.वि./ई -टेण्डरिंग/२०२३-२४/ // निविदा विज्ञप्ति //

नगर निगम अंतर्गत निम्नलिखित कार्य हेत निविदाऐ आनलाईन आमंत्रित की जाती है। उल्लेखित कार्य की निविदा का विस्तृत विवरण वेबसाईट www.mptenders.gov.in पर देखा जा सकता है।

| क्र. | ऑन लाईन | कार्य का नाम | अनुमानित | धरोहर | निविदा | समयावधि |
|------|-----------------------|---|-----------|----------|----------|---------|
| 1 | पोर्टल | | लागत | राशि | प्रपत्र | |
| 1 | | | (लाख में) | | का मूल्य | |
| 1 | 2023_UAD_ 284497_1 | स्विमिंग पूल में शीटिंग वर्क, पाथ वे, बाउंड्रीवाल, पार्किंग, गार्ड रूम निर्माण एवं विद्युतीकरण कार्य। | 115.88/- | 57,940/- | 12,500/- | 60 दिन |

निविदा ऑनलाईन क्रय एवं प्रस्तुत करने की अंतिम दिनांक निविदा खोलने की दिनांक

:- 14/07/2023 (शाम 5:30 बजे तक) :- 17/07/2023 (सुबह 10:30 बजे तक)

आयुक्त - नगर पालिक निगम, खण्डवा

निविदा संबंधी समस्त जानकारी वेबसाईट <u>www.mptenders.gov.in</u> पर देखी जा सकती है निविदा में यदि किसी भी प्रकार का संशोधन किया जाता है तो वह आनॅलाईन पोर्टल पर प्रदर्शित होगा उसे पृथक से सामाचार पत्र में प्रकाशन नहीं किया

C Kubata

Escorts Kubota Limited

एस्कॉर्ट्स कुबोटा लिमिटेड (पूर्व में एस्कॉर्ट्स लिमिटेड) CIN: L74899HR1944PLC039088

पंजीकृत कार्यालयः 15/5, मथुरा रोड, फरीदाबाद-121003, हरियाणा फोनः 0129—2250222 | फैक्सः 0129—2250060 | ई—मेलः <u>corp.secretarial@escortskubota.com</u>, वेबसाइटः <u>www.escortsgroup.com</u>

77वीं वार्षिक आम बैठक के लिए सूचना

सूचित किया जाता है कि

एतद्दवारा सूचित किया जाता है कि एस्कॉर्ट्स कुबोटा लिमिटेड ('कंपनी') के सदस्यों की 77वीं वार्षिक आम बैठक ('एजीएम') वीडियो कॉन्फ्रेंसिंग ('वीसी') / अन्य ऑडियो विजुअल ('ओएवीएम'), के माध्यम से शुक्रवार, 14 जुलाई 2023 को दोपहर 12:00 बजे (भारतीय समयानुसार) आयोजित की जाएगी, कंपनी अधिनियम, 2013 के लागू प्रावधानों व उसके तहत बनाए गए नियमों और भारतीय प्रतिभूति एवं विनिमय बोर्ड **('सेबी')** (सूचीबद्ध दायित्वों और प्रकटीकरण आवश्यकताओं) विनियम, 2015 **('सेबी लिस्टिंग विनियमन')** के सामान्य परिंपत्र संख्या के साथ पठित की अनुपालन में 14/2020, 17/2020, 18/2020, 20/2020, 02/2021, 19/2021, 21/2021, 2/2022, और 10/2022 दिनांक 8 अप्रैल, 2020, 13 अप्रैल 2020, 21 अप्रैल , 2020, 5 मई, 2020, 13 जनवरी, 2021, 8 दिसंबर, 2021, 14 दिसंबर, 2021, 5 मई, 2022 और 28 दिसंबर, 2022 क्रमशः और कॉर्पोरेट मामलों के मंत्रालय द्वारा जारी किए गए अन्य लागू परिपन्न ('MCA') और सेबी (सामूहिक रूप से 'प्रासंगिक परिपन्न' के रूप में संदर्भित), को निर्धारित व्यवसायों के लेन—देन करने के लिए एजीएम नोटिस में निर्धारित किया गया है।

2. एजीएम की सूचना और वित्तीय वर्ष ('FY') 2022—23 के लिए संकलित वार्षिक रिपोर्ट केवल उन्हीं सदस्यों को भेजी जाएगी, जिनकी ईमेल आईडी कंपनी / डिपॉजिटरी पार्टिसिपेंट के पास पंजीकृत है और यह कंपनी की वेबसाइट <u>www.escortsgroup.com</u> साथ ही स्टॉक एक्सचेंज बीएसई लिमिटेड और नेशनल स्टॉक एक्सचेंज ऑफ़ इंडिया लिमिटेड की वेबसाइट क्रमशः <u>www.bseindia.com</u> और <u>www.nseindia.com</u> पर और नेशनल सिक्योरिटीज लिमिटेड (NSDL) की वेबसाइट <u>www.evoting.nsdl.com</u> पर सूचीबद्ध है।

सदस्य केवल वीसी / ओएवीएम सुविधा के माध्यम से एजीएम में भाग ले सकते हैं। उपस्थित सदस्यों की गणना कंपनी अधिनियम की धारा—103 के तहत कोरम निर्धारित करने के उद्देश्य से की जाएगी। एजीएम में शामिल होने के निर्देश एजीएम की सूचना में दिए गए हैं। कंपनी ने शुक्रवार, 30 जून, 2023 को एजीएम में वित्तीय वर्ष 2022—23 के लिए लामांश के भुगतान के लिए पात्र सदस्यों का निर्धारण करने के लिए रिकॉर्ड

तिथि के रूप में निर्धारित किया है।

अधिनियम की धारा 91 और सेबी लिस्टिंग विनियमों के विनियम 42 के प्रावधानों के अनुसार, कंपनी के सदस्यों का रजिस्टर ("ROM") और शेयर हस्तांतरण पुस्तकें 1 जुलाई, 2023 से 14 जुलाई, 2023 तक बंद रहेंगी (दोनों दिन सहित) उक्त एजीएम में एस्कॉर्ट्स बेनिफिट एंड वेलफेयर ट्रस्ट (ट्रेजरी शेयर्स) द्वारा रखे गए शेयरों के अलावा, रिकॉर्ड तिथि यानी 30 जून, 2023 को सभी बकाया शेयरों पर अंतिम लाभांश के भुगतान के उद्देश्य के लिए 70% प्रति शेयर यानी अंकित मूल्य के 7 रुपये प्रति इक्विटी शेयर रुपये 10 प्रत्येक देय होगा।

5. जिन ईमेल पतों को कंपनी के साथ पंजीकृत/अपडेट नहीं किया गया है, उनके ईमेल पतों को पंजीकृत/अद्यतन करने का तरीकाः

भौतिक रूप में शेयर रखने वाले सदस्य भौतिक रूप में शेयर रखने वाले सदस्य और जिन्होंने कंपनी के साथ अपने ई-मेल पते अपडेट नहीं किए हैं, उनसे अनुरोध है कि वे अपने ई-मेल पते को विधिवत भर कर व हस्ताक्षरित फॉर्म ISR-1 (पैन दर्ज करने के लिए फॉर्म, केवाईसी विवरण या परिवर्तन / अपडेशन के लिए फॉर्म) जो कंपनी की वेबसाइट https://www.escortsgroup.com/investors/usefull-links/forms.html उस पर उपलब्ध है, को कंपनी रजिस्ट्रार एवं शेयर ट्रांसफर एजेंट - KFin Technologies Limited, सेलेनियम बिल्डिंग, टॉवर-बी, प्लॉट संख्या, 31 और 32, वित्तीय जिला, नानकरामगुडा, सेरिलिंगमपल्ली, हैदराबाद, रंगारेड्डी, तेलंगाना, भारत — 500032 पर भेजकर अपडेट करें अथवा https://ris.kfintech.com/clientservices/isc/default.aspx# लिंक द्वारा ई-साइन कर के इलेक्ट्रॉनिक मोड के माध्यम से भी भेजा जा सकता है।

इलेक्ट्रॉनिक मोड में शेयर रखने वाले सदस्य

सदस्यों को इलेक्ट्रॉनिक रूप से कंपनी से सभी संचार प्राप्त करने के लिए अपने संबंधित डिपॉजिटरी पार्टिसिपेंट 'डीपी' के साथ अपना ई–मेल पता पंजीकृत / अपडेट करना आवश्यक है।

ई—वोटिंग के माध्यम से वोट डालने का तरीकाः

(ए) सदस्यों के पास इलेक्ट्रॉनिक वोटिंग सिस्टम **('ई—वोटिंग')** के माध्यम से एजीएम की सूचना में निर्धारित व्यवसाय पर अपना वोट डालने का अवसर होगा। (बी) एजीएम की सूचना में डिमटेरियलाइज्ड मोड, फिजिकल मोड में शेयर रखने वाले सदस्यों और अपने ईमेल पते पंजीकृत नहीं करने वाले सदस्यों द्वारा रिमोटली वोटिंग ('रिमोट ई-वोटिंग') का तरीका प्रदान किया गया है।

(सी) इलेक्ट्रॉनिक वोटिंग सिस्टम के माध्यम से वोटिंग की सुविधा एजीएम ('इंस्टा पोल') में भी उपलब्ध कराई जाएगी और एजीएम में भाग लेने वाले सदस्य जिन्होंने रिमोट ई—वोटिंग द्वारा अपना वोट नहीं डाला है, वे इंस्टा पोल के जरिए एजीएम पर वोट करने में सक्षम होंगे।

(डी) सदस्यों को ई—वोटिंग के माध्यम से वोट डालने के लिए लॉगिन क्रेडेंशियल ईमेल के माध्यम से उपलब्ध कराया जाएगा। सदस्य जो ईमेल प्राप्त नहीं कर पाते हैं या जिनके ईमेल पते कपनी / केफिन टेक्नोलॉजीज लिमिटेड / डिपॉजिटरी पार्टिसिपेंट(ओं) के साथ पंजीकृत नहीं हैं, वे एजीएम की सूचना के नोट्स में दिए गए निर्देशों का पालन करके लॉगिन क्रेडेंशियल प्राप्त कर सकते हैं।

(ई) वीसी / ओएवीएम के माध्यम से एजीएम में भाग लेने के लिए भी उसी लॉगिन क्रेडेंशियल का उपयोग किया जा सकता है। 7. लाभांश प्राप्त करने के लिए अधिदेश दर्ज करने का तरीका'

भौतिक रूप में शेयर रखने वाले सदस्य

सदस्य फॉर्म ISR-1 और कंपनी की वेबसाइट <u>https://www.escortsgroup.com/investors/usefull-links/forms.html</u> पर उपलब्ध अन्य प्रासंगिक फॉर्म जमा करके अपने बैंक विवरण को कंपनी के रिजस्ट्रार एंड ट्रांसफर एजेंट यानी KFin Technologies Limited के पास फोलियो नंबर के विवरण के साथ पंजीकृत / अपडेट कर सकते हैं।

इलेक्ट्रॉनिक मोड में शेयर रखने वाले सदस्य

सदस्यों को अपने संबंधित डिपॉजिटरी प्रतिभागियों 'डीपी' के साथ अपने बैंक विवरण को पंजीकृत / अद्यतन करना आवश्यक है। लागांश वारंट / डिमांड ड्राफ्ट उन शेयरधारकों के पंजीकृत पते पर भेजे जाएंगे, जिन्होंने वार्षिक आम बैठक के बाद अपने बैंक खाते के विवरण को अपडेट नहीं किया है।

 सदस्यों से अनुरोध है कि वे एजीएम की सूचना में निर्धारित सभी नोट्स और विशेष रूप से एजीएम में शामिल होने के निर्देश, रिमोट ई—वोटिंग के माध्यम से या एजीएम के दौरान इंस्टा पोल के माध्यम से वोट डालने के तरीके को ध्यान से पढ़ें।

> बोर्ड के आदेश से एस्कॉट्र्स कुबोटा लिमिटेड के लिए एसडी / – सत्येंद्र चौहान

> > कंपनी सचिव

स्थानः फरीदाबाद दिनांकः 16 जून, 2023

धार्मिक आयोजन में भोजन के बाद करीब 300 लोग बीमार

जयपुर, 16 जून (भाषा)।

राजस्थान के दौसा जिले के मंडावर थाना क्षेत्र में

गुरुवार रात एक धार्मिक आयोजन में भोजन के बाद करीब 300 लोगों ने पेट दर्द, उल्टी की शिकायत की जिसके बाद उन्हें अस्पतालों में ले जाया गया।

नोटिस तिथि

शाखा का नाम एवं

ऋणी/गारन्टर के नाम

केंगरा बैंक Canara Bank 📣 कब्जा सूचना अवल सम्पत्ति के लिए, धारा ३(४) के तहत

बंधक सम्पत्ति का विवरण

एवं सम्पत्ति स्वामी का नाम

जैसा कि प्रतिभृतिकरण व वित्तीय आस्तियों का पुननिर्माण और प्रतिभृति हित का प्रवर्तन अधिनियम प्रतिभृति हित (प्रवर्तन) नियम 2002 के नियम 3 के साथ पढ़ते उनके नाम के सामने दी गई तारीओं पर नोटिस की तारीख/उक्त नोटिस की तारीख से 60 दिनों में बकाया राशि अदा करने के लिए मांग नोटिस जारी किया गया था ऋणियों/गारन्टरों द्वारा राशि अदा करने में असफल रहने पर ऋणी और जन सामान्य को नोटिस दिया जाता है कि खाते के सामने दी गई तारीख को उक्त नियमों के श्वितमान के साथ पढ़ते हुए उक्त अधिनियम की धारा 13(4) के अंतर्गत उन्हें प्रदल्त शक्तियाँ का प्रयोग करते हुए नीचे दी गई सम्पत्ति का कब्जा नीचे लिखी तिथि को ले लिया गया है। उधारकर्ता(ऑ) का ध्यान सुरक्षित परिसंपत्तियों के एवज में उपलब्ध समय के संबंध में अधिनियम की धारा 13 (8) के प्रावधानों के लिए आमंत्रित किया है। ऋणियों/गारन्टरों को विशेष रूप से एवं जन सामान्य रूप से यह चेतावनी दी जाती है कि वे उक्त सम्पत्ति के सम्बन्ध में किसी प्रकार का लेन-देन न करें। इन सम्पत्तियों में किसी प्रकार का लेन-देन केनरा बैंक, संबंधित शाखा को देय राशि एवं उस पर अर्जित ब्याज के चार्ज के पूर्ण भ्रुगतान के पश्चात ही किया जा सकता है।

| | शास्त्राः सुजा (18650) ऋणीः शाम सर्वर फीड प्रोडकर, प्रो. विमलेश शर्मा, न्यू शिव पुरी, किला रोड, सुजी, उ.प. 203131. विमलेश शर्मा एनी राम किशोर शर्मा, भारत गैस गोडाउन के पीछे, न्यू शिव पुरी, किला रोड, सुजी उ.प. 203131. जमानतकर्ताः मनीश कुमार शर्मा पुत्र राम किशोर शर्मा, मकान नं. 521, सराय मोडर सिंह, पुलिस स्टेशन सुजी, उ.प. 203131. जोन स्वाता सं.: 86501400001382, 8650710000333 जीर 86509160000189 | एक आवासाय सम्पाता ाजसका बात्रफल ८४. 98 वर्ग मीटर, खसरा नं. 1184, न्यू शिवपुरी, खुर्जा, बुलंदशहर, मालिक विमलेश शर्मा पत्नी राम किशोर शर्मा चौहददीः पूर्वः अजय राघव का घर, पश्चिमः 25 फिट चौड़ा रास्ता, उत्तरः चकरोड़ इसके बाद नाली, दक्षिणः मोरद्धज का घर। | माग नाटिस की तिथि 02.06.2021 कब्जा लेने की तिथि 12.06.2023 | 13,08,934 + ब्याज एवं अन्य व्यय। |
|----|---|--|--|---|
| 2. | शाखाः खुर्जा (18650) ऋणीः यजू शर्मा पुत्र ओमप्रकाश शर्मा, मोहल्ला बुर्ज उस्मान खान, खुर्जा, बुर्लदशहर, उ.प्र. 203131. सुनीता शर्मा मोहल्ला बुर्ज उस्मान खान, खुर्जा बुर्लदशहर उ.प्र. 203131. कामानतकतोः विपन कुमार राघव पुत्र नगवीर सिंह, 268, मुरारी नगर, खुर्जा, बुर्लदशहर, उ.प्र. 203131. | एक आवासीय सम्पत्ति जिसका क्षेत्रफल 81. 32 वर्ग मीटर, मोहल्ला बुर्ज उस्मान खान, अहीरपाड़ा खुर्जा, बुलंदशहर, मालिक राजू शर्मा पुत्र ओमप्रकाश शर्मा चौहददीः पूर्वः श्री नंदू का घर, पश्चिमः श्री शिवाली वाले का घर, उत्तरः चोपाल, दक्षिणः टीकम सिंह का घर और रास्ता गली। | मांग नोटिस की तिथि 02.06.2021 कब्जा लेने की तिथि 12.06.2023 | रू०. 21,10,588 + ब्याज एवं अन्य व्यय। |
| 3. | शाखाः खुर्जा (18650) ऋणीः ओम कम्प्यूटर्स, म्यू शिव पुरी किला रोह, खुर्जा, उ.प्र. 203131. मनीश कुमार शर्मा पुत्र राम किशोर शर्मा, मकान नं. 521, सराय मोहर सिंह, पुलिस स्टेशन खुर्जा, उ.प्र. 203131. जमानतकर्ताः विमलेश शर्मा पत्नी राम किशोर शर्मा, भारत गैस गोडाउन के पीछे, म्यू शिव पुरी, किला रोह, खुर्जा, उ.प्र. 203131. लोन साता सं: 86501400000974, 86507100000155 | एक आवासीय सम्पत्ति जिसका क्षेत्रफल 84.98 वर्ग मीटर, न्यू रोटेरी क्लब आई हॉस्पीटल, न्यू शिव पुरी, खुर्जा, बुलंदशहर, मानिक विमलेश शर्मा पत्नी राम किशोर शर्मा चौहददीः पूर्वः श्री अजय राघव का घर, पश्चिमः 25 फिट चौहा रास्ता, उत्तरः चकरोड़ उसके बाद नाली, दक्षिणः मोरह्नज का घर। | मांग नोटिस की तिथि 02.06.2021 कब्जा लेने की तिथि 12.06.2023 | रू०. 11,04,458 + ब्याज एवं अन्य व्यय। |
| 4. | शास्त्राः खुर्जा (18650) ऋणीः महक ट्रेडर्स, प्रोपराईटरीशप विजय कुमार, मंसूरपुर मीरपुर, खुर्जा, बुलंदशहर, उ.प्र. 203131. विजय कुमार पुत्र नरेश पाल, 40, मुरारी नगर, खुर्जा, बुलंदशहर, उ. प्र. 203131. जमानतकर्ताः अरून कुमार पुत्र नरेश पाल सिंह, मंसूरपुर मीरपुर, खुर्जा, बुलंदशहर, उ.प्र. 203131. | भूमि और ईमारत सम्पत्ति जिसका क्षेत्रफल 860 वर्ग मीटर, खेत नं. 9/1 एमआई का भाग, गांव मंस्रपुर, खुर्जा, बुलंदशहर, मालिक विजय कुमार पुत्र नरेश पाल चौहददीः पूर्वः जगजीत सिंह का खेत, पश्चिमः जगदीश का खेत, उत्तरः रास्ता 24 फिट चौड़ा, दक्षिणः संजय कुमार का खेत। | मांग नोटिस की तिथि 04.06.2021 कब्जा लेने की तिथि 12.06.2023 | रू०. 15,72,642 + ब्याज एवं अन्य व्यय। |
| 5. | शाखाः खुर्जा (18650) ऋणीः देवेन्द्र सिंह के/ऑफ विजय पाल सिंह, 437, गली नं. 1, किला ग्रेह न्यू शिव पुरी, खुर्जा, बुलंदशहर, उ.प्र. 203131. रेनुका विहान पत्नी देवेन्द्र सिंह, मकान नं. 606, गली नं. 9, न्यू शिव पुरी किला ग्रेह, खुर्जा बुलंदशहर, उ.प्र. 203131. लोन साता सं.: 86501400001662 - 86507650000124 | अचल पेट्रोल पम्प सम्पत्ति, साइट गाटा नं. 262 की सम्पत्ति, गांव सौंदा हबीपुर, खुर्जा, जेवर रोइ खुर्जा, बुलंदशहर, साईट का शेत्रफल 1152 वर्ज मीटर, मालिक देवेन्द्र सिंह के/ऑफ विजय पाल सिंह बीहददी: पूर्व: खुर्जा जेवर रोइ, पिश्चमः इन्द्रदेव शर्मा और रविन्द्र की भूमि, उत्तरः 8 फिट चौड़ा चकरोइ, दक्षिणः इन्द्रदेव शर्मा और रविन्द्र की भूमि। | मांग नोटिस की तिथि 16.04.2021 कब्जा लेने की तिथि 12.06.2023 | रू०. 34,99,681 + ब्याज एवं अन्य व्यय। |
| 6. | शाखाः खुर्जा (18650) ऋणीः अरीश एण्टर्याईजेज, प्रो. अंशुल सुरारी नगर नेहरूपुर चूंगि, शंकर होटल के पीछे, खुर्जा, बुलंदशहर, उ.प्र. 203131. अंशुल पुत्र हबीब खान, 22 पंजाबियन, खुर्जा, बुलंदशहर, उ.प्र. 203131. जमानतकर्ताः हबीब खान पुत्र राशिद खान, 22 पंजाबियन, खुर्जा, बुलंदशहर, उ.प्र. 203131. | एक भूमि और ईमारत जिसका क्षेत्रफल 828 वर्ग मीटर, गाटा नं. 197 का भाग, आउटसाईड चूंगि, सपना पौटरी के पास, तहसील खुर्जा बुलंदशहर, मालिक हबीब खान पुत्र राशीद खान चौहददी: पूर्तः रास्ता 21 फिट चौड़ा, पश्चिमः फरीद की भूमि, उत्तरः जमीत भाई रहीश खान का प्लॉट, दक्षिणः मदन लाल की पौटरी। | मांग नोटिस की तिथि 04.06.2021 कब्जा लेने की तिथि 12.06.2023 | रू०. 30,27,397 + ब्याज एवं अन्य व्यय। |
| 7. | शाखाः खुर्जा (18650) ऋणीः आलिफ ओवरसील, प्रो. सैमरीन सुहेल, 15, शेख साहिबान, खुर्जा, बुलंदशहर, उ.प्र. 203131. सैमरीन सुहेल पत्नी सुहेल, मकान नं. 13, शेख साहिबान, खुर्जा, बुलंदशहर, उ.प्र. 203131. जमानतकर्ताः सुहेल हाशमी पुत्र अखलक अहमद, 13, जहीर मंजिल शेख साहिबान, खुर्जा, बुलंदशहर, उ.प्र. 203131. | एक आवासीय सम्पति जिसका क्षेत्रफल ८४४. 43 वर्ग फिट, मकान नं. 15, मोहल्ला शेख साहिबान, मदस्या के पास, तहसील खुर्जा, बुलंदशहर, मालिक सैमरीन सुहेल पत्नी सुहेल चौहददी: पूर्व: अन्य का घर, पश्चिम: रास्ता ९ फिट चौड़ा, उत्तर: इलियान का घर, दिक्षण: मदरसा। | मांग नोटिस की तिथि 04.06.2021 कब्जा लेने की तिथि 12.06.2023 | रू०. 16,93,600 + ब्याज एवं अन्य व्यय। |

This advertisement is for information purposes only and not for publication, distribution, or release directly or indirectly outside India. This is not an announcement for the offer document. All capitalized terms used herein and not confined herein shall have the meaning assigned to them in the Letter of Offer dated May 23, 2023 (the "Letter of Offer" or "LOF") filed with the Main Board of BSE Limited ("BSE") and the Securities and Exchange Board of India ("SEBI") for information and dissemination on the

Requirements) Regulations, 2018 ("SEBI (ICDR) Regulations"). SHARANAM INFRAPROJECT AND TRADING LIMITED

Corporate Identification Number: L45201GJ1992PLC093662 Regd. Office: 303, Earth Arise, Nr. Y.M.C.A. Club, S. G. Road, Makarba, Vejalpur, Ahmedabad - 380051, Gujarat

Email id: sharanaminfraproject@gmail.com, Website: www.sharanaminfra.co.in Telephone no. 079 2970 7666 Contact Person: Mr. Jinesh Deepakkumar Mistry, Company Secretary and Compliance Officer

Dur Company was originally incorporated with the name and style Skyhigh Projects Limited under the Companies Act 1956 or 5th day of February, 1992 having Corporate Identification Number L45201PB1992PLC012001. Thereafter the name of the Company had been changed from Skyhigh Projects Limited to Sharanam Infraproject and Trading Limited with effect 29th day of July, 2015 and received a fresh Certificate of Incorporation from the Registrar of Companies, Chandigarh dated July 29, 2015. $The equity shares of our Company were \ listed on Main Board of BSE \ Limited on January 21, 2016. \ The Scrip symbol 'SIPTL' and Company were \ listed on Main Board of BSE \ Limited on January 21, 2016. \ The Scrip symbol 'SIPTL' and Company were \ listed on Main Board of BSE \ Limited on January 21, 2016. \ The Scrip symbol 'SIPTL' and Company were \ listed on Main Board of BSE \ Limited on January 21, 2016. \ The Scrip symbol 'SIPTL' and \ Limited on Main Board of BSE \ Limited on Main BSE \$ ISIN INE104S010221. The Corporate Identification Number of our Company is L45201GJ1992PLC093662.

The company is a professionally managed company and functions through their Board of Directors. The Company doesn't have any identifiable promoter.

NOTICE TO THE ELIGIBLE EQUITY SHARE HOLDERS OF SHARANAM INFRAPROJECT AND TRADING LIMITED -CORRIGENDUM CUM ADDENDUM TO LETTER OF OFFER DATED MAY 23, 2023

RIGHT ISSUE EXTENDED: REVISED ACTIVITY SCHEDULE **ISSUE PROGRAMME**

ISSUE OPENED ON WEDNESDAY, MAY 31, 2023

ISSUE CLOSES ON THURSDAY, JUNE 29, 2023

ISSUE OF 75001500 EQUITY SHARES WITH A FACE VALUE OF ₹ 1 EACH ("**RIGHTS EQUITY SHARES**") OF OUR COMPANY FOR CASH AT A PRICE OF ₹ 1 EACH AT A PAR ("ISSUE PRICE") FOR AN AGGREGATE AMOUNT ₹ 750.02 LACS ON A RIGHTS BASIS TO THE ELIGIBLE EQUITY SHAREHOLDERS OF OUR COMPANY IN THE RATIO OF 3 RIGHTS EQUITY SHARES FOR EVERY 2 FULLY PAID-UP EQUITY SHARES HELD BY THE ELIGIBLE EQUITY SHAREHOLDERS ON THE RECORD DATE, THAT IS ON MAY 22, 2023 (THE "ISSUE"). THE ISSUE PRICE FOR THE RIGHTS EQUITY SHARES IS 1 TIME THE FACE VALUE OF THE EQUITY SHARES. FOR FURTHER DETAILS, SEE "TERMS OF THE ISSUE" ON PAGE 93 OF THE LETTER OF OFFER.

ASBA*

Simple, Safe, Smart way of Application- Make use of it!!!

*Application Supported by Blocked Amount (ASBA) is a better way of applying to issues by simply blocking the fund in the bank account, investors can avail the same. For further details check section on ASBA below.

In accordance with Regulation 76 of the SEBI (ICDR) Regulations, SEBI Circulars no. SEBI/CFD/DIL/ASBA/1/2009/30/12 dated December 30, 2009, CIR/CFD/DIL/1/2011 dated April 29, 2011 and SEBI/HO/CFD/DIL2/CIR/P/2020/13 dated January 22, 2020 ("SEBI ASBA Circulars"), all Investors desiring to make an Application in this Issue are mandatorily required to use the ASBA process. Investors should carefully read the provisions applicable to such Applications before making their Application $through \, ASBA. \, For \, details \, ``Process \, of \, making \, an \, Application \, in \, this \, Issue" \, on \, page \, 94 \, of \, Letter \, of \, Offer.$

PLEASE NOTE THAT RESIDENT INVESTORS CAN SUBMIT THEIR APPLICATION USING THE ASBA PROCESS ONLY. ASBA FACILITY IS OPERATIONAL FROM THE ISSUE OPENING DATE.

This is to inform the eligible shareholders of the company that the date of closure of the rights issue, which opened on Wednesday, May 31, 2023 scheduled to close on Friday, June 9, 2023 which was earlier extended by the company from Friday, June 9, 2023 to Tuesday, June 20, 2023, vide the board resolution dated Friday, June 2, 2023, in order to provide an opportunity to shareholders to exercise their rights in the rights issue.

FURTHER. THIS IS TO INFORM THE ELIGIBLE SHAREHOLDERS OF THE COMPANY THAT THE DATE OF CLOSURE OF THE RIGHTS ISSUE, WHICH WAS EARLIER EXTENDED BY THE COMPANY FROM FRIDAY, JUNE 9, 2023 TO TUESDAY, JUNE 20, 2023, HAS BEEN FURTHER EXTENDED TO THURSDAY, JUNE 29, 2023 VIDE THE BOARD RESOLUTION DATED FRIDAY, JUNE 16, 2023, IN ORDER TO PROVIDE AN OPPORTUNITY TO SHAREHOLDERS TO EXERCISE THEIR RIGHTS IN THE RIGHTS

Please note that on the Issue Closing Date, Applications through ASBA process will be uploaded until 5.00 p.m. (Indian Standard

Time) or such extended time as permitted by the Stock Exchange or such extended time as permitted by the Stock Exchange. ACCORDINGLY, THE LAST DATE OF SUBMISSION OF DULY FILLED IN APPLICATION FORM IS THURSDAY, JUNE 29, 2023,

BEING THE ISSUE CLOSING DATE. ALLOTMENT OF THE RIGHTS EQUITY SHARES IN DEMATERIALIZED FORM:

Please note that the rights equity shares applied for in this issue can be allotted only in dematerialized form and to the same depository account in which our equity shares are held by such investor on the record date.

ELIGIBLE SHAREHOLDERS OF THE COMPANY WHO ARE ENTITLED TO APPLY FOR THE RIGHTS ISSUE ARE REQUESTED TO TAKE NOTE OF THE ISSUE CLOSURE I.E. THURSDAY, JUNE 29, 2023. ACCORDINGLY, THERE IS NO CHANGE IN LETTER OF OFFER, ABRIDGED LETTER OF OFFER, STATUTORY ADVERTISEMENT, ENTITLEMENT LETTER, AND APPLICATION FORM EXCEPT THE MODIFICATION IN THE ISSUE CLOSING DATE, RESULTNANT CHANGE IN INDICATIVE TIME TABLE OF POST ISSUE ACTIVITIES ON ACCOUNT OF EXTENSION OF ISSUE CLOSING DATE.

For, SHARANAM INFRAPROJECT AND TRADING LIMITED

Mr. Jinesh Deepakkumar Mistry Date: June 16, 2023 Place: Ahmedabad Company Secretary and Compliance Officer

MARKETS

Fresh closing highs for indices

MEGHNA SINHA Mumbai, June 16

THE FINAL SESSION of the week brought cheer to investors, as a strong buying interest and positive global cues propelled the benchmarks to record closing highs. Spurred by the interest in banking and financials, as well as consumer goods, the Sensex and Nifty50 closed at fresh highs even as they fell short of their all-time peaks.

"Our markets are driven by strong flows from local and global investors. There is lack of supply from the primary and secondary markets, which has propelled markets to lifetime highs," said Nilesh Shah, MD and CEO of Kotak MF. "Investor flows are driven by the 3G of (earnings) growth, (corporate) governance and green - commitment is expected to be higher than peers."

The Sensex surged 467 points or 0.74% to close at 63,384. During the session, the index was up 514 points, but fell shy of its all-time high of 63,583.07. A total of 2,048

THE GOVERNMENT HAS

fixed the issue price at ₹5,926

per gram of gold for the first

tranche of the Sovereign Gold

Bond Scheme 2023-24, which

NIB No./ Date/

Unique bid no.

1902/15.06.2023

RIS2324GLOB00027

Raj.Samwad/C/23/4207

completed as of 16" June, 2023.

www.evoting.nsdl.com.

note the following:

End of remote e-voting

to vote during the AGM.

Commencement of remote e-voting

to change it subsequently or cast the vote again.

capital of the Company as of the cut-off date.

password can be used for casting the vote.

Depository Participant.

have queries regarding e-voting:

financialexp.epapr.in

Cut-Off Date

Sensex Dec 30, 2022 June 16, 2023 Investors wealth (₹ trn) Smallcap Midcap

ATA GLANCE

Nifty 3.98 **BSE Midcap** 11.92 **BSE Smallcap** 11.63 Investors wealth gain ₹10.4 trn

265 sessions — between Octo-

ber 18, 2021 and November

11, 2022 — to go from

traded in sync with the trend

and ended in the green. Top

gainers in the Sensex were

The issue price of the bond during the subscription period

would be ₹5,926, it said. The

government in consultation

with the Reserve Bank of India

ලක අවකා ලක මින

Most of the sectoral indices

61,765.59 to 62,795.04.

statement on Friday.

Return (YTD, %)

4.18

to hit a new closing high for the stocks advanced on the BSE, while 1,480 declined. The Sensex, with the previous clos-Nifty closed at 18,826, a little ing high of 63,284 coming on over 23 points away from its December 1, 2022. The last lifetime high of 18,887.70 time the Sensex crossed a prescaled in December 2022. vious high, it took the index

Shankar Sharma, founder of GQuant, said: "I do believe the India party that started in 1991 has just entered its most exciting session! And it's not too late for newbies: jump right

in and make merry!" It took 134 trading sessions

The issue will be opened for

subscription during the period

June 19-23, 2023, with the set-

tlement date of June 27, the

Cost/ EMD

Rs. 02.00 Crore 15.06.202

Rs. 04.00 Lacs | 06.07.2023

General Manager (Technical)

five days from Monday.

will open for subscription for finance ministry said in a

RFP for Supply, Installation and

Maintenance of IT Equipment's

for SMS Medical College &

Details can be seen on the websites http://sppp.rajasthan.gov.in

http://risl.rajasthan.gov.in, & http://doitc.rajasthan.gov.in. Bids are to be

ZIM LABORATORIES LIMITED

CIN: L99999MH1984PLC032172

Registered Office : Sadoday Gyan (Ground Floor), Opp. NADT, Nelson Square, Nagpur - 440 013, Maharashtra, India.

Website: www.zimlab.in, e-mail: cs@zimlab.in

Telephone No. Registered Office: 0712-2981960, Works Office: 07118-271990

NOTICE OF THE 39" ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

Notice is hereby given that the 39" Annual General Meeting (AGM) of the

Company will be held on Monday, 10" July, 2023 at 11:30 a.m. IST through

/ideo Conferencing (VC)/ Other Audio Visual Means (OAVM) in compliance

with the applicable circulars issued by the Ministry of Corporate Affairs

The Notice setting out the Ordinary and Special Business(es) to be

ransacted during the AGM and the Annual Report for F.Y. 2022-23 has been

sent through emails to the members whose email IDs were registered with

the Company / Depository Participants. The email dissemination has been

The Notice of the AGM and the Annual Report are available on the website

of the Company, i.e., www.zimlab.in under the Investors section, the

websites of the Stock Exchanges, i.e., www.bseindia.com and

www.nseindia.com; and on the website of NSDL, i.e.

In terms of the provisions of section 108 and other applicable provisions

f any, of the Companies Act, 2013, read with the Companies (Management and Administration) Rules, 2014, as amended, and Regulation 44 of the

Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure

Requirements) Regulations, 2015, the Company is pleased to provide to its

Members the facility to exercise their right to vote on business as set forth in

the Notice of the 39th AGM by electronic means through both remote e-

voting and e-voting at the AGM. The Company has appointed the National

Securities Depository Limited (NSDL) as the agency to provide an

Members holding shares as of the cut off date may cast their votes using

Remote e-voting will be disabled by NSDL upon the expiration of the

The facility for voting through the e-voting system will also be made

available during the AGM. Members attending the AGM through the VC

OAVM facility who have not cast their votes by remote e-voting will be able

Members who have cast their votes on the resolutions through remote e-

voting prior to the AGM will be eligible to attend the AGM but will not be

eligible to cast their vote on such resolutions at the meeting again. Once the

vote on the resolution is cast by a member, the member will not be allowed

Only those members whose names are recorded in the register of

members or in the register of beneficial owners maintained by the

depositories as of the cut-off date shall be entitled to avail themselves of the

facility of remote e-voting or e-voting at the AGM. The voting rights of

Members shall be in proportion to their share in the paid-up equity share

Any person who becomes a member of the Company after the Company

sends the Notice of the 39" AGM by email and holds shares as of the cut-off

date, i.e., 03" July, 2023 may obtain a User ID and password by sending a

request to the Company's email address cs@zimlab.in. However, if a person

is already registered with NSDL for e-voting, then their existing user ID and

The members of the Company holding shares in physical form and who

have not registered their e-mail IDs are requested to provide a duly signed

Form ISR-1 along with supporting documents to the Company's RTA - Link

Intime India Pvt. Ltd., at their office at 247 Park, C-101 L.B.S. Marg, Vikhroli

(West), Mumbai 400083, Tel: +91 22 49186270, or by email at

rnt.helpdesk@linkintime.co.in. The said form is available on the website of

the RTA at https://web.linkintime.co.in/KYC-downloads.html. Members

holding shares in the demat form can update their e-mail address with their

by the Board of Directors of the Company as the Scrutinizer for scrutinizing

the remote e-voting process and voting at the AGM in a fair and transparent

Ms. Roshni Jethani, Practising Company Secretary, has been appointed

The results of the remote e-voting and votes cast at the AGM shall be

declared on or before 12" July, 2023. The Results declared, along with the

Scrutinizer's Report, shall be placed on the Company's website,

www.zimlab.in and on the website of NSDL, i.e., www.evoting.nsdl.com

immediately after their declaration, and communicated to the Stock

Members who need technical assistance before or during the AGM or

They may refer to the Frequently Asked Questions (FAQs) and the e-voting

user manual available at the download section of www.evoting.nsdl.com

Send a request to Mr. Amit Vishal, Senior Manager, or Ms. Pallavi Mhatre,

Manager, NSDL, at evoting@nsdl.co.in/022-48867000/022-24997000.

Exchanges where the Company is listed, viz., BSE Limited and NSE Limited.

Monday, 03rd July, 2023

Friday, 07" July, 2023

(From 09:00 a.m. IST)

Sunday, 09" July, 2023

(Up to 5:00 p.m. IST)

an electronic voting system (remote e-voting). All members may please

(MCA) and Securities and Exchange Board of India (SEBI).

RISL invites e-bids from the eligible bidders for the following

submitted through http://eproc.rajasthan.gov.in.

RajCOMP Info Services Limited (RISL)

C-Block, 1" Floor, Yojana Bhawan, Tilak Marg, C-Scheme, Jaipur

Sovereign gold bond: Issue price fixed at ₹5,926/gram

Start of sale

/Last date

Bajaj Finserv (2.21%), Titan (1.67%), Kotak Mahindra Bank (1.32%) and HDFC Bank (1.30%). The only laggard was the IT sector, with heavyweights like Wipro, HCL Tech and Infosys falling around 2%.

The rally continued in the broader market as both the BSE MidCap and SmallCap ended higher, pushing the mcap of BSElisted stocks to an all-time closing

high of ₹292.78 trillion. The Bank Nifty jumped 494.55 points or 1.14% to 43,938.15, with Bandhan, IDFC First, Bank of Baroda gaining over 2%. The index is less than 500 points away from its lifetime high of 44,436.35.

"The Bank Nifty recovered on Friday, but the benchmark Nifty has been faring better on a week-on-week basis. The positive development is that the Bank Nifty has reclaimed the 44,000-mark. With 43,500 being the support, it can also breach 44,450. Private banks are doing better than PSUs," said Chandan Taparia, head (technical and derivatives research), Motilal Oswal.

has decided to allow a discount

of ₹50 per gram from the issue

price to those investors who

apply online and the payment

is made through digital mode,

'Lokmangal', 1501, Shivajinagar,

Pune-411005. 020-25537367 / 313

Head Office, Corporate Services Department,

Deputy General Manager (Corporate Services)

No. 29/1, 1st Floor, Sir M N Krishna Rao Road

Near Lalbagh West Gate, Basavanagudi,

E-mail: compsec@canfinhomes.com

Tel:080 48536192, 080 41261144

Web: www.canfinhomes.com

CIN: L85110KA1987PLC008699

Bank of Maharashtra

Can Fin Homes Limited

Bengaluru - 560 004

Fax:080 26565746

it said.

Tender Notice

Insurance Companies in India who satisfy pre-qualification criteria set out

Insurance Coverage of Assets owned by the Bank.

in the RFP document for providing following insurance coverage.

Bankers Indemnity Policy

Locker Insurance Policy

www.bankofmaharashtra.in/tenders.

22nd June 2023 up to 3.00 p.m.

Can Fin Homes Ltd

(Sponsor: CANARA BANK)
HOME LOANS + DEPOSITS

ಕ್ಯಾನ್ ಫಿನ್ ಹೋಮ್ ಲಿ.

Group personal Accident Policy

Motor Fleet Insurance Policy

ast date for submission of sealed quotation is :-

All other details of RFP are available on our website:-

Debit Card Policy

Credit Card Policy

State Bank of India chairman Dinesh Khara (centre) handing over the dividend cheque for ₹5,740 crore to finance

Special drawing rights were up by

FOREX RESERVES DROPPED

It can be noted that in October 2021, the country's forex kitty had reached an all-time high of \$645 billion. The reserves have been declining as the central bank deploys the Jan 6, 2023 June 9, 2023

kitty to defend the rupee amid pressures caused majorly by

tical Supplement, released by the RBI on Friday.

593.75

Expressed in dollar terms, foreign currency assets include the effect of appreciation or depreciation of non-US units like the euro, pound and yen held in the forex reserves.

Gold reserves dropped by

\$183 million to \$45.374 billion, the RBI said.

Special drawing rights were up by \$2 million to \$18.187 billion. The country's reserve position with the IMF was down by \$8 million to \$5.115 billion in the reporting week,

the central bank data showed. The rupee rose 0.20% for the reporting week. On Friday, it closed at 81.94, up 24 paise or 0.30%. "The expected pull failed to gain momentum once inside the 82.20-82.30 region. Expect an attempt to regroup near 81.96 and attempt another upswing, but it may take a few days of consolidation. The 81.75 view is not as favoured, for now," Anand James, chief market strategist, Geojit Financial Services, said.

IKIO makes strong market



SHARES OF LED manufacturing company IKIO Lighting made a bumper market debut price of ₹285 per share. It listed ₹390 on the BSE. Intra-day, the

The ₹607-crore IPO, which opened for subscription on June 6 and closed on June 8, received good response. The category of qualified institutional buyers was subscribed 163.06 times, non-institutional investors 65.38 times and the public issue 14.31 times. It had a price band of ₹270-285 with a lot size of 52.

Atotal of 6.38 lakh shares at a price of ₹285 per share were allotted to 16 anchor investors. including Goldman Sachs (12.09%), Quant Value Fund (9.31%), HDFCMF (9.16%) and

It is the third-largest IPO by issue size so far in FY24. Other two large companies which got listed since April 2023 are Mankind Pharma (issue size ₹4,326 crore) and Avalon Technologies (₹865 crore). A total of 28 IPOs have got listed so far in

"The listing has happened

Forex kitty shrinks \$1.3 bn to \$594 bn

minister Nirmala Sitharaman on Friday

ALL SMILES

by \$1.318 billion to \$593.749 billion for the week ended June 9, the Reserve Bank of India said on Friday. Overall reserves had jumped by \$5.93 billion to \$595.067 billion for the previ-

global developments. For the week ended June 9,

foreign currency assets, a major component of the reserves, decreased by \$1.128 billion to \$525.073 billion, according to the Weekly Statis-

Sudhir Kumar Gupta

EX. ENGINEER-(M)-62 (T-2)

debut



MEGHNA SINHA Mumbai, June 16

on Friday, ending with a 37.72% gain over the issue at ₹392.50 on the NSE and stock touched a high of ₹427.50 on the NSE, but shed some gains before settling at ₹404.50.

ICICI Prudential MF (9.07%).

the current fiscal.

on a far better ground than expected by the Street. The company will use the funds in greenfield capex which can be its driving force. The entire electronics manufacturing sector has got rerated in the last threefour months. Therefore, other companies in this segment like Kaynes Technology, Syrma SGS, etcare also doing well. Investors looking to invest can buy below ₹400. I believe the stock has a 20% upside potential and can reach ₹470-480 levels in a year," Sunny Agrawal, head of fundamental retail research,

SBI Securities, said.

Ahmedabad

INDIA'S FOREX RESERVES

\$2 mn to \$18.18 bn

FE BUREAU Mumbai, June 16

ous reporting week.

DELHI JAL BOARD: GOVERNMENT OF N.C.T. OF DELHI OFFICE OF THE ADDITIONAL CHIEF ENGINEER (M)-1 **EXECUTIVE ENGINEER (M)-62 / T-2** E-BLOCK PARK: PREET VIHAR: DELHI-110092 Phone No. 22502206, Mail ID: - djbeeeastii@gmail.com PRESS NIT No. 08 (2023-24)

(\$ billion)

615

600

585

570

540_

Amount Put Tender Earnest Tender ID No. & Date of Last Date / Time o Release of tender in E- receipt of tender E-Processing Replacement / Rectification of old settled 300 mm dia 500.00 2023_DJB_243048_1 sewer line at Ghazipur Village B Gali No.2, E, G 24, 38,90,691.00 16-Jun-2023 02:00 PM 09:00 AM Hiring of suction cum jetting machine (Mahindra 2023 DJB 243048 26-Jun-2023 Bolero 1500 liters capacity) for removal of blockage 02:00 PM 16-Jun-2023 and cleaning of sewer line in narrow lanes for ward no. 18E (Anand Vihar) under EE (M)-59. (Re-invited)

Further details in this regard can be seen at https://govtprocurement.delhi.gov.in. ISSUED BY P.R.O. (WATER) Advt. No. J.S.V. 66 (2023-24)

This advertisement is for information purposes only and not for publication, distribution, or release directly or indirectly outside

NOTICE

(Information to Equity Shareholders of the Company)

Shareholders are hereby informed that pursuant to the provisions of Rule 6 of Investor Education and Protection Fund Authority (IEPF) (Accounting, Audit, Transfer & Refund) Rules, 2016 as amended from time to time, the dividend declared during the financial year 2015-16 i.e, on July 20, 2016, which remained unclaimed for a period of seven years, will be due for transfer to IEPF. The Company will not transfer such shares to the IEPF where there is a specific order of Court/ tribunal restraining any transfer of such shares or where the shares are hypothecated / pledged under the Depositories Act, 1996.

The corresponding shares on which dividend was unclaimed for seven consecutive years will also be transferred as per the procedure set out in the said Rules read with amended Rules, 2021.

In compliance of the said Rules, the Company has communicated individually to the concerned shareholders and the details of such shares liable to be transferred to IEPF are also made available on our website. Shareholders concerned may refer to 'Investor' page on our website: www.canfinhomes.com to verify their Name, folio/DPID-Client ID and unclaimed dividend amount. Shareholders are requested to claim the dividend declared during the financial year 2015-16 and subsequent years, if any, by July 19, 2023 before the same is transferred to the IEPF.

Concerned shareholders holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF, may note that the Company would be issuing a new share certificate(s) in lieu of the original held by them for the purpose of transfer of shares to IEPF and upon such issue, the Company shall inform the depository by way of corporate action to convert the new share certificates into DEMAT form and transfer in favour of IEPF Authorities. The original share certificate(s) which are registered in the name of original shareholders will stand automatically cancelled and be deemed non-negotiable. Concerned shareholders holding shares in dematerialized form may note that the Company shall inform the depository by way of corporate action for transfer of shares in favour of the DEMAT account of the IEPF Authority.

In case the Company does not receive any communication from the concerned shareholders by July 19, 2023, the Company will be constrained to transfer the Dividend 2016 amounts to the IEPF by the due date in compliance of the said rules. The corresponding shares on which dividend is unclaimed for seven consecutive years shall also be transferred without any further notice.

Please note that no claim shall lie against the Company in respect of unclaimed dividend amount and shares transferred to IEPF. Shareholders may claim the dividend and corresponding shares transferred to IEPF, including all benefits accruing on such shares, if any, from IEPF authorities after following the procedure prescribed in the Rules.

For any queries on the above matter, please contact the Company's Registrar & Share Transfer Agents, Mr. B S Naidu, Manager at M/s Canbank Computer Services Ltd., Tel: + 91 80 23469661 or send e-mail to naidu@ccsl.co.in or investor.relationship@canfinhomes.com For Can Fin Homes Limited

Place: Bengaluru Veena G Kamath DGM & Company Secretary India. This is not an announcement for the offer document. All capitalized terms used herein and not confined herein shall have the meaning assigned to them in the Letter of Offer dated May 23, 2023 (the "Letter of Offer" or "LOF") filed with the Main Board of BSE Limited ("BSE") and the Securities and Exchange Board of India ("SEBI") for information and dissemination on the SEBI's website pursuant to the proviso to Regulation 3 of the Securities Exchange Board of India (Issue of Capital and Disclosure Requirements) Regulations, 2018 ("SEBI (ICDR) Regulations").

SHARANAM INFRAPROJECT AND TRADING LIMITED Corporate Identification Number: L45201GJ1992PLC093662

Regd. Office: 303, Earth Arise, Nr. Y.M.C.A. Club, S. G. Road, Makarba, Vejalpur, Ahmedabad - 380051, Gujarat Email id: sharanaminfraproject@gmail.com, Website: www.sharanaminfra.co.in Telephone no. 079 2970 7666 Contact Person: Mr. Jinesh Deepakkumar Mistry, Company Secretary and Compliance Officer

Our Company was originally incorporated with the name and style Skyhigh Projects Limited under the Companies Act 1956 on 5th day of February, 1992 having Corporate Identification Number L45201PB1992PLC012001. Thereafter the name of the Company had been changed from Skyhigh Projects Limited to Sharanam Infraproject and Trading Limited with effect 29th day of July, 2015 and received a fresh Certificate of Incorporation from the Registrar of Companies, Chandigarh dated July 29, 2015 The equity shares of our Company were listed on Main Board of BSE Limited on January 21, 2016. The Scrip symbol 'SIPTL' and ISIN 'INE104S01022'. The Corporate Identification Number of our Company is L45201GJ1992PLC093662

The company is a professionally managed company and functions through their Board of Directors. The Company doesn' have any identifiable promoter.

NOTICE TO THE ELIGIBLE EQUITY SHARE HOLDERS OF

SHARANAM INFRAPROJECT AND TRADING LIMITED -CORRIGENDUM CUM ADDENDUM TO LETTER OF OFFER DATED MAY 23, 2023 RIGHT ISSUE EXTENDED: REVISED ACTIVITY SCHEDULE **ISSUE PROGRAMME**

ISSUE CLOSES ON

ISSUE OPENED ON WEDNESDAY, MAY 31, 2023

THURSDAY, JUNE 29, 2023 ISSUE OF 75001500 EQUITY SHARES WITH A FACE VALUE OF ₹ 1 EACH ("RIGHTS EQUITY SHARES") OF OUR COMPAN

FOR CASH AT A PRICE OF ₹ 1 EACH AT A PAR ("ISSUE PRICE") FOR AN AGGREGATE AMOUNT ₹ 750.02 LACS ON A RIGHTS BASIS TO THE ELIGIBLE EQUITY SHAREHOLDERS OF OUR COMPANY IN THE RATIO OF 3 RIGHTS EQUITY SHARES FOR EVER 2 FULLY PAID-UP EQUITY SHARES HELD BY THE ELIGIBLE EQUITY SHAREHOLDERS ON THE RECORD DATE, THAT IS ON MAY 22, 2023 (THE "ISSUE"). THE ISSUE PRICE FOR THE RIGHTS EQUITY SHARES IS 1 TIME THE FACE VALUE OF THE EQUITY SHARES. FOR FURTHER DETAILS, SEE "TERMS OF THE ISSUE" ON PAGE 93 OF THE LETTER OF OFFER. Simple, Safe, Smart way of Application- Make use of it!!!

ASBA*

*Application Supported by Blocked Amount (ASBA) is a better way of applying to issues by simply blocking the fund in the bank account, investors can avail the same. For further details check section on ASBA below. accordance with Regulation 76 of the SEBI (ICDR) Regulations, SEBI Circulars no. SEBI/CFD/DIL/ASBA/1/2009/30/12 dated

December 30, 2009, CIR/CFD/DIL/1/2011 dated April 29, 2011 and SEBI/HO/CFD/DIL2/CIR/P/2020/13 dated January 22, 2020 ("SEBI ASBA Circulars"), all Investors desiring to make an Application in this Issue are mandatorily required to use the ASBA process. Investors should carefully read the provisions applicable to such Applications before making their Application through ASBA. For details "Process of making an Application in this Issue" on page 94 of Letter of Offer. PLEASE NOTE THAT RESIDENT INVESTORS CAN SUBMIT THEIR APPLICATION USING THE ASBA PROCESS ONLY. ASBA

FACILITY IS OPERATIONAL FROM THE ISSUE OPENING DATE. LAST DATE FOR APPLICATION:

This is to inform the eligible shareholders of the company that the date of closure of the rights issue, which opened or Wednesday, May 31, 2023 scheduled to close on Friday, June 9, 2023 which was earlier extended by the company from Friday, June 9, 2023 to Tuesday, June 20, 2023, vide the board resolution dated Friday, June 2, 2023, in order to provide an opportunity to shareholders to exercise their rights in the rights issue.

FURTHER, THIS IS TO INFORM THE ELIGIBLE SHAREHOLDERS OF THE COMPANY THAT THE DATE OF CLOSURE OF THE RIGHTS ISSUE, WHICH WAS EARLIER EXTENDED BY THE COMPANY FROM FRIDAY, JUNE 9, 2023 TO TUESDAY, JUNE 20. 2023, HAS BEEN FURTHER EXTENDED TO THURSDAY, JUNE 29, 2023 VIDE THE BOARD RESOLUTION DATED FRIDAY, JUNE 16, 2023, IN ORDER TO PROVIDE AN OPPORTUNITY TO SHAREHOLDERS TO EXERCISE THEIR RIGHTS IN THE RIGHTS

Please note that on the Issue Closing Date, Applications through ASBA process will be uploaded until 5.00 p.m. (Indian Standard Time) or such extended time as permitted by the Stock Exchange or such extended time as permitted by the Stock Exchange. ACCORDINGLY, THE LAST DATE OF SUBMISSION OF DULY FILLED IN APPLICATION FORM IS THURSDAY, JUNE 29, 2023. BEING THE ISSUE CLOSING DATE.

ALLOTMENT OF THE RIGHTS EQUITY SHARES IN DEMATERIALIZED FORM:

Please note that the rights equity shares applied for in this issue can be allotted only in dematerialized form and to the same depository account in which our equity shares are held by such investor on the record date.

ELIGIBLE SHAREHOLDERS OF THE COMPANY WHO ARE ENTITLED TO APPLY FOR THE RIGHTS ISSUE ARE REQUESTED TO TAKE NOTE OF THE ISSUE CLOSURE I.E. THURSDAY, JUNE 29, 2023, ACCORDINGLY, THERE IS NO CHANGE IN LETTER OF OFFER, ABRIDGED LETTER OF OFFER, STATUTORY ADVERTISEMENT, ENTITLEMENT LETTER, AND APPLICATION FORM EXCEPT THE MODIFICATION IN THE ISSUE CLOSING DATE, RESULTNANT CHANGE IN INDICATIVE TIME TABLE OF POST ISSUE ACTIVITIES ON ACCOUNT OF EXTENSION OF ISSUE CLOSING DATE.

For, SHARANAM INFRAPROJECT AND TRADING LIMITED

Mr. Jinesh Deepakkumar Mistry Company Secretary and Compliance Officer

Date: 17.06.2023 (Piyush Nikhade) Place : Nagpur Company Secretary & Compliance Officer



By Order of the Board of Directors

For ZIM LABORATORIES LIMITED

Date: 16/06/2023

Date: June 16, 2023

Place: Ahmedabad